

વર્ષ ૨૨ અંક ૩, સાંગ અંક ૮૦ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭

# બૈશાહી



## નાગરિકોની ફરીયાદોનો સશક્ત અવાજ



<b>संपादकीय</b>	<b>3</b>
■ फरियाद निवारण व्यवस्था: अनुभवो अने बोधपोठ	4
■ चंपारण सत्याग्रहनुं पुर्नलोकनः असंगठित महिलाओने संगठित करवा माटे 'सेवा'नो बोधपाठ	7
■ व्यथाना प्रत्यक्ष बयानोनी महत्वता: चंपारणना 'गणी'ना ऐदूतोनी स्थिति अंगेना गांधीजीना अभ्यासना अंशो	14
■ 'ट्रिपल तलाक' अंगेनो चुकादो मुस्लिम महिलाओनी वास्तविक दृष्टिशास्त्र दूर करवामां निष्फળ	19
■ समुदायो केवी रीते स्पर्शर्या विना गटर व्यवस्थानुं व्यवस्थापन करी शके?	23
■ जण योज्ञा: बुंदेलखण्डमां 'जण सહेलीओ' बनी नारी सशक्तिकरणानुं उत्कृष्ट उदाहरण	25

# સંપાદકીય

## નાગરિકોની ફરીયાદોનો સશક્ત અવાજ -

યુવાઓ દ્વારા 'સોશ્યલ મિડિયા'નો ઉપયોગ

સામાન્ય નાગરિકોની સાચી ફરીયાદોનું નિવારણ ન થાય ત્યારે સામાન્ય રીતે સરકારને જવાબદેહ બનાવવા હેતુ સંગઠન, વિરોધ પ્રદર્શન અને જાહેર સુનાવણીઓ વગેરે કરવામાં આવે છે, નાગરિકોના અધિકારો પ્રાપ્ત કરવા માટેની આ સહભાગી પ્રક્રિયા છે. સદી પછેલા 1917માં ચંપારણમાં ગળીનાં ખેડૂતોની અમાનવીય સ્થિતિની સામે ગાંધીજીએ ખેડૂતોની વથાના પ્રત્યક્ષ બયાનો (ટેસ્ટીમની)નો ઉપયોગ કર્યો હતો, તેથી ચંપારણ કૃષિ ધારો ઘડાયો. જો કે, આનાથી ખેડૂતોના બધા જ પ્રશ્નોનો ઉકેલ તો ન આવ્યો પરંતુ તેમની યાતનાઓમાં ઘણી રાહત થઈ. ગાંધીજી કહેતા હતા કે 'સાચા અર્થમાં સ્વરાજ ત્યારે જ મળશે જ્યારે આવાં ઘડાં નાગરિકોની સ્થિતિમાં સુધારો આવે'. જો કે આ પ્રકારની પદ્ધતિમાં નાગરિકોએ સમય આપવો પડે અને જાતે ઉપસ્થિત રહેવું પડે.

છેલ્લાં દાયકામાં 'ઈન્ટરનેટ' અને 'મોબાઇલ'નો બહોળો વપરાશ વધ્યો છે. 'ફેસબુક' અને 'વોટ્સઅપ'નો ઉપયોગ નાગરિકો પોતાના મંત્રયો રજૂ કરવા અને સ્થિતિ દર્શાવવા કરે છે. 'સોશ્યલ મિડિયા'ના માધ્યમો ત્રણ મુખ્ય પરીબળ (પ્રતિનિધિત્વ, જોડાણ અને નેટવર્ક) દ્વારા શાસનમાં નાગરિકોની ભાગીદારી દર્શાવે છે. 'સ્માર્ટ ફોન'નાં ઉપયોગ દ્વારા પુરાવા આધારિત ભાષા અને માહિતી સુનિશ્ચિત થાય છે. જો કે, સોશ્યલ મિડિયા દ્વારા ખોટી માહિતી અને વિગતોનો બહોળો પ્રસાર મુખ્ય ચિંતા છે.

સાંપ્રદાત્ત સમયમાં યુવાનો દ્વારા સામાજિક મુદ્દાઓ, બીનઅસરકારક જાહેર સેવાઓ (દા.ત. શાળાઓ, દવાખાના), મહિલા હિંસા, દલિતો પ્રત્યે ભેદભાવ તેમજ શહેરી, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યક્રમોથી થતાં વિસ્થાપન અંગેની વિગતોનો પ્રસાર કરવા માટે સોશ્યલ મિડિયાનો ઉપયોગ થાય છે. જો ટ્રોલીંગ (વાતને નકારવી અથવા ઉતારી પાડવા)ને ધ્યાને ન લઈએ તો સોશ્યલ મિડિયા હાલની આર્થિક સામાજિક સ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવા માટેનું મહત્વાનું માધ્યમ છે. આ અદ્રશ્ય માધ્યમ હોવાથી સીધુ જોડાણ કે સંગઠનો અભાવ હોઈ શકે પરંતુ અનુભવે જોતાં, આ માધ્યમ દ્વારા સામૂહિક અવાજ અને માહિતીની ખરાઈ સાથે વિવિધ પ્રદેશ, જગ્યા અને વિવિધ લોકો દ્વારા લેવાયેલાં સામૂહિક પગલાં ઉદાહરણીય છે. આમ, સામાન્ય રીતે પ્રત્યક્ષ વિરોધ પ્રદર્શનમાં જોડાતા નાગરિકો કરતાં ઘણી મોટી સંખ્યામાં નાગરિકો જોડાય છે. 'સોશ્યલ મિડિયા' દ્વારા ઘણાં ઓછા સમયમાં (મિનિટોમાં) વિશાળ જનસમૂહ સુધી માહિતીનો પ્રસાર કરી શકાય છે, જેથી સબંધિત સત્તામંડળો, લોકો અને સંસ્થાઓ ઉપર ફરીયાદ નિવારણ માટે દબાણ ઊભું થાય છે. વ્યક્તિગત વથાનું પ્રત્યક્ષ બયાન (ટેસ્ટીમની)ને જાહેરમાં દર્શાવવાનું આ પગલું પોતે જ સશક્તિકરણની પ્રક્રિયા છે જે ફરીયાદ નિવારણ માટે દબાણ બનાવે છે.

સશક્તિકરણ, યોગ્ય વિશેષજ્ઞાન અને દુરંદેશી માટે સહભાગી અને સામૂહિક કાર્ય મહત્વાની પદ્ધતિ છે. હાલમાં ઘણાં એવા ઉદાહરણો છે જેમાં યુવાનો દ્વારા નાની વિદ્યાઓ કલીપ, ફિલ્મ, ફોટો વગેરે દ્વારા દમદાર સંદેશનો પ્રસાર કરવામાં આવ્યો છે, જેના અંગે અમુક એવોર્ડ પણ જીત્યા છે. હાલમાં જ બહોળો પ્રસાર થયેલ જાતીય સત્તામણી સામે સોશ્યલ મિડિયા કેમ્પેઇન 'MeToo' થયું હતું. મહિલાઓ પોતાના જીવનમાં થયેલ કોઈ પણ પ્રકારની જાતીય સત્તામણીના અનુભવોને 'MeToo' (હેઝટેગ) હેઠળ પોતાના ફેસબુક પર રજૂ કર્યું અને આ સમસ્યાની તીવ્રતા અને માત્રાને દર્શાવી હતી. હજારોની સંખ્યામાં મહિલાઓએ ઈન્ટરનેટ દ્વારા ફેસબુક પર પોતાની કથનીઓ રજૂ કરી હતી.

લોકોની ફરીયાદો અને વિચારોને રજૂ કરવા માટે આવા પ્રકારના સમુદ્દ્ર પ્રેરીત મિડિયા પ્રોજેક્ટ ઘડવા માટે યુવાનો તેનું કેન્દ્ર બિન્દુ બની શકે. આ દ્વારા સરકાર સહિતના વિવિધ હિતધારકોના જોડાણથી બદલાવના કાર્ય માટે સ્થાનિક હકીકતોનો દમદાર સંદેશ તૈયાર કરી બદલાવની પ્રક્રિયા આરંભી શકાય. લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ માટે 'સોશ્યલ મિડિયા' એ એક મહત્વાની પદ્ધતિ છે જેનો હજુ સુધી બહોળો અને રચનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો નથી.

# ફરિયાદ નિવારણ વ્યવસ્થા: અનુભવો અને બોધપાઠ

- ટિલીપ સિંહ બિદાવત અને તોલારામ ચૌહાણ, ઉન્નતિ

આ લેખમાં રાજ્યસ્થાનના બાડમેર જિલ્લામાં જાહેર કાર્યક્રમોની પહોંચ વધારવા અંગેના 'યુરોપીયન યુનિયન'ની સહાય ધરાવતા ગ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે લોકોને તેમના મળવાપાત્ર લાભો અને હક્કો મેળવવા સક્ષમ કરવા માટે વિવિધ (સરકારી કે બિન-સરકારી) ફરિયાદ નિવારણ વ્યવસ્થાનો ઉપયોગ કરવા અંગેના અનુભવો તથા અવલોકનોની રજૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમના અમલ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોકોને તેમને મળવાપાત્ર લાભ પ્રાપ્ત થાય તે માટે યોજનાઓ અને કાર્યક્રમો અંગેની માહિતીનો પ્રચાર કરવો કે લોકો તેમના અધિકારો અને લાભો માટે માગણી કરે તે પૂર્તું નથી. લોકોને યોજનાઓ માટેની અરજી કરવા માટે, તેમની પાત્રતા પુરવાર કરવા માટે સહાયક દસ્તાવેજો તૈયાર કરવા માટે તથા ખરાઈ અને મંજૂરીની જટિલ પ્રક્રિયા પાર પાડવા માટે મદદની જરૂર પડે છે. જે લોકોને પૂરો લાભ ન મળ્યો હોય અથવા તો લાભથી વંચિત રહ્યા હોય તેવા લોકોને ફરિયાદ નિવારણ વ્યવસ્થાની જરૂર પડે છે.

સામાન્યપણે લોકોએ સંપર્ક સાધવો અથવા જે-તે ફરિયાદ ક્યાં નોંધાવવી તેની જાણકારી ધરાવતા નથી. તેઓ સ્થાનિક કર્મચારીઓને મૌખિક ફરિયાદ કરે છે. પરંતુ, સ્થાનિક કર્મચારીઓ તેમને યોગ્ય પ્રતિભાવ આપતા નથી અથવા તો તેમની ફરિયાદને ગંભીરતાથી લેતા નથી. ઘણી વખત તો આ કર્મચારીઓ પણ પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી. કેટલીક વખત લોકો વચેટિયાઓની મદદ લે છે અને આ માટે તેમણે ગજા બહારની રકમ ચૂકવવી પડે છે. જે ગણીગાંઠી વ્યક્તિઓ ફરિયાદ નોંધાવવામાં સફળ થાય, તેમને ફરિયાદની સ્થિતિ જાણવા શું કરવું તે વિશે કોઈ માહિતી હોતી નથી. ગામ અને તાલુકા સત્તરે જાહેર કાર્યક્રમના અમલીકરણ અંગે કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી. વળી, પ્રશ્નોના નિરાકરણ માટે સામૂહિક એકમત કે માગ પણ જોવા મળતાં નથી. ફરિયાદની નોંધણી ન થાય અથવા તો તેનું નિરાકરણ ન થાય, તો લોકો નિસહાયતા અનુભવે છે અને આખરે, જાહેર કાર્યક્રમ ગમે તેટલો મહત્વ કે મૂલ્યવાન હોય, તો પણ તેમને તેનો લાભ મેળવવાની પ્રક્રિયા પડતી મૂકવાની ફરજ પડે છે. આથી, ફરિયાદની નોંધણી કરવામાં અને તેની સ્થિતિ જાણવામાં લોકોને સહાય પૂરી પાડવી જરૂરી છે, જેથી આ માટેની સામુદ્દર્યક ક્ષમતા વધારી શકાય. 'ઉન્નતિ' દ્વારા રાજ્યસ્થાનના બાડમેર જિલ્લાના સિણાધરી અને પાટોદી બ્લોકમાં શરૂ કરવામાં આવેલાં અભિયાનો, રૂબરૂ મુલાકાતો અને માહિતી શિબિરોના આધારે તેમજ

કાર્યક્રમના ભાગરૂપે બ્લોક સત્તરે સ્થાપવામાં આવેલાં માહિતી સંસાધન કેન્દ્રો (ઇન્ફર્મેશન રિસોર્સ સેન્ટર્સ - આઇઆરસી) અને ગામમાં યોજાતી સામુદ્દર્યક બેઠક દરમિયાન લોકોએ કરેલી રજૂઆતોના આધારે લોકોની ફરિયાદો વિશે જાણકારી મેળવવામાં આવી હતી.

## રાજ્યસ્થાનમાં જાહેર કાર્યક્રમો માટેની ફરિયાદ નિવારણ વ્યવસ્થા

લોકો તેમની ફરિયાદો નોંધાવી શકે તથા તેની સ્થિતિ જાણી શકે તે માટે સરકારે વિવિધ કાયદા તથા વ્યવસ્થાઓ પ્રસ્થાપિત કર્યા છે, જેનાં અમૃક ઉદાહરણો નીચે પ્રમાણે છે:

1. 'ગેરન્ટીડ ડિલિવરી ઓફ પબ્લિક સર્વિસેજ એક્ટ, 2011' જે મળવાપાત્ર લાભો, સેવાની ગુણવત્તા તથા લોકોને ક્યાં સુધીમાં સેવાનો લાભ મળી રહેવો જોઈએ તેની સમય મર્યાદા સૂચવે છે.
2. 'રાઇટ ટુ હિયરિંગ એક્ટ, 2012' - જે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય સત્તરે ફરિયાદ નોંધણી અને જાહેર સુનાવણી સંદર્ભે છે.
3. રાજ્યસ્થાન સંપર્ક એ નિશ્ચિયત સમય અવધિમાં ફરિયાદના નિવારણ માટેની સુશ્રયિત ફરિયાદ નિવારણ વ્યવસ્થા છે. તે ઓન-લાઇન પોર્ટલ છે અને સાથે જ ટોલ ફી ફોન નંબર દ્વારા પણ તેનો સંપર્ક સાધી શકાય છે. જાહેર સુનાવણીઓમાં મળેલી તમામ ફરિયાદને પણ 24 કલાકની અંદર પોર્ટલમાં અપલોડ કરી દેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે, જેથી જે-તે ફરિયાદની સ્થિતિ વિશે જાણકારી મેળવી શકાય.
4. કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક ગ્રિવન્સિઝ (પીજ) પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે.
5. વિવિધ સરકારી વિભાગો દ્વારા અલાયદા ટોલ ફી નંબર શરૂ કરવામાં આવ્યા છે.
6. ફરિયાદ નિવારણ માટે બ્લોક અને જિલ્લા સતરના અધિકારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી શકાય છે અથવા તો લેખિત અરજી પાડવી શકાય છે.

**નોંધવામાં આવેલી ફરિયાદોની સ્થિતિ જાણવા માટેની પ્રક્રિયા**  
કરવામાં આવેલી ફરિયાદ જે-તે વિભાગ સુધી પહોંચે તે સુનિશ્ચિયત કરવાની સાથે સાથે તેની સ્થિતિ વિશે જાણકારી મળી રહે, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સ્થિતિની જાણકારી મેળવવાથી નિરાકરણનો

દર વધારવામાં મદદ ભળી શકે છે. પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવેલું દરેક ગામ ગ્રામ નોંધણી પત્રક (વિલેજ રજિસ્ટર) ધરાવે છે. ગામડાંઓની મુલાકાત દરમિયાન, ફરિયાદોને તારીખ સાથે નોંધવામાં આવે છે. ગ્રાહિયાના દરેક તબક્કાની ગતિવિધિ નોંધવામાં આવે છે. ઉકેલાઈ ગયેલા કેસોની પણ નોંધ કરવામાં આવે છે. રેકોર્ડની જાળવણીની પ્રક્રિયાને સરળ કરી દેવાઈ છે, જેથી લોકો સ્વયં આ પ્રક્રિયા પાર પાડી શકે. દરેક એન્ટ્રી હાથ પરના પ્રશ્નો, તેમાં કરવામાં આવેલી કાર્યવાહી, તેની સ્થિતિ અને તે પ્રશ્ન ઉકેલાયો કે નહીં તેની વિગતો ધરાવે છે. દર મહિને ગામ સ્તરીય સામુદ્દરિક બેઠક દરમિયાન ફરિયાદોની સ્થિતિની ચકાસણી કરવામાં આવે છે. જો ફરિયાદોનું નિરાકરણ ન થયું હોય, તો આગળની કાર્યવાહી હાથ ધરાય છે.

ઓનલાઇન પોર્ટલમાં નોંધવામાં આવેલી તમામ ફરિયાદોની અરજી કર્યાની તારીખને ધ્યાનમાં રાખીને ફરિયાદની સ્થિતિ જાણવામાં આવે છે તથા શું કાર્યવાહી થઈ અને અરજીના સંદર્ભમાં કામગીરી ક્યા તબક્કે પહોંચી તેના પર નજર રાખવામાં આવે છે. પ્રક્રિયા અને નિરાકરણમાં વિલંબ થાય, તો તે પણ જાણી શકાય છે. આ મહત્વપૂર્ણ છે, કારણ કે જો કેસનું નિરાકરણ આવી ગયું અને અરજીકર્તા આ ઉકેલથી સંતુષ્ટ ન હોય, તો આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તે જાણવું જરૂરી છે. જો અરજી પર થતી કાર્યવાહીની સ્થિતિ પર નજર રાખવામાં આવે, તો આમ થઈ શકે છે. ઘણી વખત અમુક વિભાગને કેસ મોકલવામાં આવે છે અને તેમને પ્રતિભાવ આપવાનું જણાવવામાં આવે છે. આમ કરવાથી ફરિયાદનું નિવારણ નથી થતું. આમ, કેસ યોગ્ય ઉકેલ વિના બંધ કરી દેવાયો છે કે કેમ તેની જાણકારી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે.

## વિવિધ વ્યવસ્થાઓ માટે ફરિયાદ નિવારણનો દર

અહીં દર્શાવેલા કોષ્ટકમાં સામાન્યપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ફરિયાદ નિવારણ વ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે: (1) રાજ્યસ્થાન સંપર્ક ઓનલાઇન પોર્ટલ, (2) સત્તા તંત્ર સમક્ષ રૂબરૂ ફરિયાદ (મૌખિક અને/અથવા લેખિત નિવેદન) અને (3) જાહેર સુનાવણીઓ અને સરકારી ફરિયાદ નિવારણ શિબિર દરમિયાન 2જૂ કરવામાં આવેલી ફરિયાદો. ઉપરોક્ત તમામ વ્યવસ્થાઓ લોકો માટે જુદું-જુદું મહત્વ ધરાવે છે. રૂબરૂ ફરિયાદનો દર સૌથી ઊંચો - 75 ટકા છે. જો કે, ફક્ત મુશ્કેલ અને જટિલ કેસ હોય ત્યારે, અને તે પણ સત્તા તંત્રને ફરિયાદ કરી ચૂક્યા બાદ જ લોકોએ રાજ્યસ્થાન સંપર્ક ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આ પોર્ટલ નવી વ્યવસ્થા છે અને તેમાં વ્યક્તિની ઓળખ છતી થતી નથી. જેના કારણે જટિલ અને ગંભીર ફરિયાદો નોંધાવતી વખતે અને લાંબા સમયથી પડતર રહેલી ફરિયાદો વિશે 2જૂઆત કરતી વખતે વ્યક્તિ સલામતી અનુભવે છે.

મુખ્યત્વે ચાર પ્રકારની ફરિયાદો છે: (1) પેન્શન, એમજીનરેગા વેતન તથા વિદ્યાર્થીઓની શ્યુકરણિની ચૂકવણીમાં વિલંબ થયો હોય અથવા ચૂકવણી ન થઈ હોય. (2) આંગણવાડી જેવી જાહેર યોજનાઓ નિષ્ક્રિય હોય, શિક્ષકો ગેરહાજર રહેતા હોય, જાહેર વિતરણ વ્યવસ્થા - પીડીએસમાં ગેરરીતિ ચાલતી હોય, વગેરે, (3) મંજૂરી મેળવવા માટે નાણાં ચૂકવવામાં આવ્યાં હોય, અને (5) માર્ગોના જોડાણ, પાણીના પુરવઠા, વીજ બિલમાં વધારો વગેરે માટેની માગ. નોંધાયેલી કુલ પૈકીની 73.5 ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે ઘણી જ પ્રોત્સાહક બાબત છે. આ પરથી ફરિયાદ નિવારણ વ્યવસ્થાની તાકાત જાણી શકાય છે.

ફરિયાદનો પ્રકાર	રાજ્યસ્થાન સંપર્ક પોર્ટલ			અધિકારીઓ સમક્ષ રૂબરૂ ફરિયાદ			સરકાર દ્વારા આયોજિત શિબિરો અને લોક સુનાવણીઓ		
	નોંધણી	ઉકેલ	ટકા	નોંધણી	ઉકેલ	ટકા	નોંધણી	ઉકેલ	ટકા
1. ચૂકવણી નહીં અને ચૂકવણીમાં વિલંબ	99	44	44	522	423	81	223	161	72
2. સમુદ્દરને લક્ષ્યમાં રાખતી જાહેર યોજનાઓની નિષ્ક્રિયતા	9	2	22	11	8	72	1	0	0
3. ભ્રષ્ટાચાર	16	1	6	3	1	33	2	1	50
4. અન્ય	29	17	58	80	31	39	34	7	21
કુલ	169	64	38	618	463	75	260	169	65

સંબંધિત સત્તા તંત્ર સમક્ષ મૌખિક કે લેખિત ફરિયાદ કરવી એ ફરિયાદ નોંધાવવા માટેની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. કુલ 1047 કેસ નોંધાયા હતા, તે પૈકીના 618 કેસ - 59 ટકા કેસ આ પ્રકારે નોંધાયા હતા. આ વર્ગમાં ફરિયાદનું નિરાકરણ આવવાનો દર પણ ઘણો ઊંચો - 75 ટકા રહ્યો હતો. જો કે, ફરિયાદો ઘણી જ સરળ હતી, જેમ કે પેન્શનની ફાળવણી, વગેરે. સંપર્ક પોર્ટલ, ટોલ ફી નંબર વગેરે દ્વારા ફરિયાદ કરવાનો દર 16 ટકા છે. મોટા ભાગે બ્રાષ્ટાચારના કેસ દાખલ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. આ પદ્ધતિને કારણે ફરિયાદીની ઓળખ છતી થતી નથી, જેના કારણે લોકો વિના સંકોચે ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવવાની આ નવી પદ્ધતિ છે અને લોકો હજુ ડિજિટલ માધ્યમથી એટલા વાકેફ નથી. લોક સુનાવણી (જન સુનવાઈ) અને સરકારી અભિયાનો થકી ફરિયાદ નોંધાવવાનો દર 25 ટકા હતો. આ શ્રેષ્ઠીમાં દાખલ થયેલા કેસ સત્તાધિશો સમક્ષ કરવામાં આવેલી મૌખિક કે લેખિત ફરિયાદો પ્રકારના છે. સરકારી તંત્ર સક્રિયપણે ગામડાંઓમાં પહોંચ વિસ્તારી રહ્યું છે, ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ હવે કેસ નોંધાવી શકે છે. નિવારણનો દર પણ ઘણો ઊંચો છે.

## વિવિધ માધ્યમો દ્વારા ફરિયાદ નિવારણના અનુભવ

### ક. સત્તા તંત્ર સમક્ષ મૌખિક કે લેખિત ફરિયાદ

- પેન્શનની ચૂકવણી, એમજનરેગા ડેટા વેતનની ચૂકવણી, પાણી પુરવઠો, આંગણવાડીઓ તથા નર્સોની અનિયમિતતા વગેરે સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થયો હતો.
- ફરિયાદને લગતા સરકારી આદેશો, સાક્ષીઓની જુબાની સાથેની લેખિત ફરિયાદો અને નિયમો અને માર્ગદર્શિકાઓ જેવા દસ્તાવેજો સુપરત કરવાથી અધિકારીઓએ ઝડપી પગલાં બર્યા હતાં.
- સામૂહિક દબાણ ઊંભું કરવાનો માર્ગ પણ ઉપયોગી બન્યો હતો.

### પડકારો

રહેઠાણ સંબંધિત ચૂકવણીઓ, બ્રાષ્ટાચાર, અપૂરતા સ્ટાફને કારણે વિવિધ યોજનાઓ મેળવવામાં થતો વિલંબ, સેવા પૂરી પાડવામાં અનિયમિતતા વગેરે જેવાં ક્ષેત્રોને લગતા જટિલ કેસોમાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી. વળી, નીતિ સ્તરના પ્રશ્નો પર પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

### ખ. લોક સુનાવણી અને સરકારી ફરિયાદ નિવારણ ઝૂંબેશ

જન સુનાવણી એ અસરકારક પદ્ધતિ છે. જન સુનાવણી દરમિયાન સરળ સમસ્યાઓનું તત્કાળ નિરાકરણ લાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું છે. આ ઝૂંબેશને પગલે લોકોને તેમની ફરિયાદો નોંધાવવાની તક મળે છે.

### પડકારો

જન સુનાવણીને કારણે અમલકર્તા અધિકારીઓ અને કર્મચારીઓ

પર અસરકારક સેવા પૂરી પાડવાનું દબાણ ઊંભું થતું હોવા છતાં, ઘણી વખત ફરિયાદોને આગામી કાર્યવાહી માટે રાખી મૂકવામાં આવે, તે પછી તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જાહેર મંચ પર રજૂઆત અને કામગીરીની ઢીલને કારણે સ્થાપિત હિતોને ફરિયાદીને તેની ફરિયાદ પાછી બેંચી લેવાનું દબાણ કરવાની તક મળી રહે છે.

### ગ. ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થા

રાજ્યસ્થાન સંપર્ક પોર્ટલ લોકોને ફોન દ્વારા કે લેખિતમાં તેમની ફરિયાદ નોંધવાનો વિકલ્પ પૂરો પાડે છે. રાજ્ય સ્તરે ફરિયાદ નિવારણ પર નજર રાખતી ચુસ્ત વ્યવસ્થા છે. ફરિયાદ દાખલ કરવામાં આવી હોય, તેના 15મા દિવસે ફરિયાદની સ્થિતિ અપડેટ કરવામાં આવે છે. સાથે જ, ફરિયાદ પુનઃ નોંધવાનો વિકલ્પ પણ મોજૂદ છે. ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું કે નહીં, તે અંગેનો તેના નિકાલનો રેકૉર્ડ કેસને મજબૂત કરતો સબળ પુરાવો છે. આ પુરાવો અમલકર્તા અધિકારીઓ પર દબાણ લાવે છે.

### પડકારો

સમુદ્યાય હજુ ઓનલાઇન વ્યવસ્થાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બન્યો નથી. ફરિયાદ લખવાની શૈલી પણ ઘણી જ અગત્યની બની રહે છે, તે સિવાય ફરિયાદમાં ઘણી ભૂલો હોવાનું કારણ આગળ ધરીને ફરિયાદને રદ કરી દેવાય છે. જો નિયમિતપણે ફરિયાદની સ્થિતિ જાણવામાં ન આવે, તો નિરાકરણ આવવામાં વિલંબ થાય છે. ઘણી વખત છ-મિત્ર ફરિયાદ દાખલ કરવા માટે સરકારે નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલે છે. કેટલીક વખત, સેવા પૂરી પાડનારાઓ ફરિયાદ નિવારણની સ્થિતિ અંગે ખોટો અહેવાલ આપે છે, જેના કારણે ફરિયાદનો ખોટી રીતે નિકાલ થાય છે.

### ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત કરવા માટેના પગલાં

1. સાતત્યપૂર્ણતા સુનિશ્ચિત થાય તે માટે લોક સમૂહને ગામ સ્તરની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે સક્ષમ કરવો જોઈએ. કેટલાક સભ્યોને આ અંગેનું શિક્ષણ તથા તાલીમ પૂરાં પાડવાં જોઈએ જેથી તેઓ સ્વયં તેમની ફરિયાદ તૈયાર કરી શકે, તેનું વિશ્લેષણ કરી શકે અને ફરિયાદ નોંધવા માટેની વિવિધ વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકે. સમુદ્યાયમાં ફરિયાદ નિવારણના વિવિધ તબક્કાઓ તથા જિલ્લા અને તાલુકા સ્તરે લોક સુનાવણીઓના ઉપયોગ અંગેની સમજ વિકસાવવી જોઈએ. ગામ સ્થિત સંગઠને રાજ્ય સ્તરે તેમની ફરિયાદો અંગે રજૂઆત કરી શકે, તે માટે તેમની સક્ષમતા વધારવી જોઈએ.
2. ફરિયાદની સ્થિતિ જાણવાની વ્યવસ્થા સરળ બનાવવી જોઈએ.
3. નીતિ વિષયક પ્રશ્નો પર ધ્યાન આપવા માટે રાજ્ય સ્તરનું નેટવર્ક ઊંભું કરવું જોઈએ. બ્રાષ્ટાચાર તથા અન્ય વિસંગતતાઓના

**જુઓ પૃષ્ઠ 27**

# ચંપારણ સત્યાગ્રહનું પુર્ણલોકન:

અસંગઠિત મહિલાઓને સંગઠિત કરવા માટે 'સેવા'નો બોધપાઠ

- મિરાઈ ચેટ્ટણી

ડિરેક્ટર, 'સેવા' સામાજિક સુરક્ષા અને ચેરપર્સન, 'સેવા' કોઓપરેટિવ ફેડરેશન

રાષ્ટ્રીય પરિસંવાદ 'ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ: પ્રયાસ, વારસો અને સમકાળીન ભારત',  
'ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી', શિમલા ખાતે પ્રસ્તુત, મે 29-31, 2017

દેશની આજાઈની ચળવળમાં ચંપારણ સત્યાગ્રહ ઘણો નિર્ણયક બની રહ્યો હતો. આ સત્યાગ્રહ ભારતમાં તથા વિશ્વનાં અન્ય સ્થળોએ સામાજિક અને આર્થિક ન્યાય માટેનાં આંદોલનોનો પ્રેરણસોત બન્યો. ભારતમાં તથા હવે આંકિક અને દિક્ષિણ-પૂર્વ એશિયામાં 'સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન - 'સેવા'ની કામગીરી ચંપારણ સત્યાગ્રહ અને વધુ વ્યાપક સ્તરે જોતાં ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત આવી જ એક ચળવળ છે.

'સેવા'નો ઉદ્ભવ 1972માં મજૂર મહાજન અથવા તો ટેક્સટાઇલ લેબરર્સ એસોસિએશન (ટીએલએ)ના ટેક્સટાઇલ કામદારોના મંડળમાંથી થયો હતો. ગાંધીજી અને અનસૂયાબેન સારાભાઈએ 1920માં મજૂર મહાજનની સ્થાપના કરી હતી. 1918માં, કાપડ ઉદ્યોગના કામદારોની અવદશા તેમજ ઓગસ્ટ 1917થી જાન્યુઆરી 1918 દરમિયાન ખેગની મહામારી ફાટી નિકળી, તે સમયે મિલ માલિકોએ કામદારોને આપવામાં આવતું 'ખેગ બોન્સ' રદ કર્યું, તેને પગલે ગાંધીજી અને અનસૂયાબેન સારાભાઈએ વેતનમાં 35 ટકાનો વધારો કરવાની માગણી સાથે હડતાળ પાડવા માટે કાર્યકરોને સંગઠિત કર્યા. મજૂર મહાજનની સ્થાપના થઈ, તે અગાઉ અનસૂયાબેને મિલ કામદારોની સ્થિતિ અને ગુજરાન ચલાવવા માટે તેમણે વેઠવા પડતા સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. એટલું જ નહીં, તેમના સ્વયંના ભાઈ, મિલ-માલિક અંબાલાલ સારાભાઈ સમક્ષ મિલ કામદારોનાં હિતોનું પ્રતિનિધિત્વ પણ કર્યું. ગાંધીજીએ અગાઉ ચંપારણમાં કરેલી કામગીરીની માફક જ તેમણે અને અનસૂયાબેને મિલ કામદારોને સંગઠિત કર્યા અને આરોગ્ય, શિક્ષણ તથા સામાજિક સમાવેશકતા જેવા પ્રશ્નો ઉઠાવવાની હાકલ કરી.

શ્રમિક વકીલ (લેબર લોયર) અને સંગઠક હલાબેન ભટ્ટ મજૂર મહાજનમાં જોડાયાં તે દરમિયાન લાખો મિલ કામદારો સંગઠિત થઈ ચૂક્યા હતા. કાપડ ઉદ્યોગના મિલ-માલિકો સાથે તમામ પ્રકારની વાટાવાટોમાં મિલ કામદારોનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત મજૂર મહાજને અમદાવાદ તથા ગુજરાતના જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રનાં ઘણાં ચાવીરૂપ પાસાંઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટૂક સમયમાં જ છલાબેન મજૂર મહાજનની મહિલા પાંખના ડિરેક્ટર પદે નિયુક્ત થયાં, તેમણે કૌશલ્ય વર્ધનના વર્ગનું આયોજન કર્યું તથા કાપડ મિલોની મહિલા કામદારો માટે શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ હાથ ધરી. આ ગાળામાં જ હાથલારી ખેંચીને ગુજરાન ચલાવતી સુપાબાઈએ છલાબેનની મુલાકાત લીધી અને તેણે અમદાવાદના મુખ્ય કાપડ બજારમાં તેની તથા અન્ય મહિલાઓ સાથે થતા અન્યાયની વિગતો વર્ણવી. તેણે જાણાયું કે તે અને અન્ય મહિલાઓ શહેરના ભરયક માર્ગ વચ્ચેથી માથા ઉપર અથવા તો લારીમાં કાપડની ગાંસડીઓ ભરીને લઈ જતી, જે માટે 60ના દાયકામાં તેમને રોજના માંડ 50 પૈસા મળતા. સુપાબાઈએ જાણાવેલી હક્કીકતોથી છલાબેન હચમચી ઊઠ્યાં અને પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે તેઓ સ્વયં સુપાબાઈ સાથે બઝારે ગયાં. જેવી રીતે ચંપારણના ગળીના બેદૂતોની અવદશા તરફ ગાંધીજીનું ધ્યાન દોરવા બદલ રાજકુમાર શુક્લા અદ્કેરું સ્થાન ધરાવે છે, તે જ રીતે છલાબેનને શ્રમિક મહિલાઓની દુંદશાથી વાકેફ કરવા બદલ સુપાબાઈ હંમેશા 'સેવા'માં ચિરસ્મરણીય સ્થાન ધરાવશે.

## 'માથોડા કામદાર' સત્યાગ્રહ અને 'સેવા'નો જન્મ

ચંપારણ ખાતે ગાંધીજી અને તેમના અન્યાયીઓએ અપનાવેલી વ્યૂહરચનાઓને અનુસરીને છલાબેન હાથ-લારી ખેંચનારા અથવા તો માથોડા કામદારોને મળ્યાં, તેમના જીવન-ધોરણ અને કાર્યની સ્થિતિનો સર્વે હાથ ધર્યો અને ઊંચા વેતનભથ્થાં અને બહેતર કાર્ય-સ્થિતિની માગણી સાથેની નોંધ તૈયાર કરવામાં સુપાબાઈ તથા અન્ય કામદારોને મદદ પૂરી પાડી. ગાંધીજી અને અનસૂયાબેન દાયકાઓ અગાઉ અજમાવેલા પ્રયોગની માફક જ કામદારોની માગણીઓને ચોપાનિયાં અથવા તો પત્રિકાઓએ ગુજરાતીમાં છપાવવામાં આવી. કાપડ બજારના વેપારીઓએ સુપાબાઈ તથા અન્ય મહિલા કામદારો માટે કંઈ પણ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. એટલું જ નહીં, 1918માં મિલ કામદારોની હડતાળના સમયે બન્યું હતું તે રીતે, મહિલા શ્રમિકોની માગણીના વિરોધમાં તેમણે પણ પોતાના બચાવમાં ચોપાનિયાં અને જાહેરાતો છપાવી હતી. વેપારીઓ સાથેની મદાગંઠનો કોઈ ઉકેલ ન આવતાં, લારી ખેંચનારાઓએ ત્યાર બાદ સુપાબાઈ

અને છલાબેનની આગેવાની ડેઠળ કાર્ય થંભાવી દીધું. શહેરમાં અસંગઠિત મહિલા શ્રમિકોને સંગઠિત કરવાનો અને સત્યાગ્રહ કરવાનો આ પ્રથમ બનાવ હતો. આખરે, ઘડી વાટાધાટોના અંતે વેપારીઓ હાથ-લારી ખેંચનારા શ્રમિકો તથા શ્રમ વિભાગના કર્મચારીઓનું વેતન વધારવા માટે અને સાથે જ, કામદારો, નોકરીદાતાઓ અને શ્રમ વિભાગના કર્મચારીઓના ત્રિપદી પ્રતિનિધિત્વ સાથેનું ‘માથોડા કામદાર બોર્ડ’ રચવા માટે સંમત થયા. આ બોર્ડ આજે પણ કાર્યરત છે. તે વેતન વધારા, કલ્યાણકારી લાભો અને કાર્યસ્થળે બહેતર સુવિધા માટેની મંત્રણા હાથ ધરે છે. ગાંધીજીએ શરૂ કરેલી પરંપરા તથા ચંપારણ સત્યાગ્રહ અને કાપડ મિલના કામદારોની હડતાળ દરમિયાન ગાંધીજીએ અપનાવેલી તકરારના નિવારણની પ્રક્રિયાને અનુસરતાં, બોર્ડ ચર્ચાઓ અને વાટાધાટોના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં તમામ સંબંધિત જૂથોને પારદર્શી રીતે સામેલ કરવામાં આવે છે.

લારી ખેંચનારી મહિલા શ્રમિકોએ વેઠવી પડતી વાવસાયિક અડયણોને પ્રકાશમાં લાવવાનું શ્રેય પણ ‘માથોડા કામદાર’ ચળવળને જાય છે. બીજું એક તથ્ય એ પણ સામે આવ્યું કે તેમની પાસે ફરિયાદ કરવા માટે કે ફરિયાદ-નિવારણ માટે કોઈ મંચ નહોતો. મહિલાઓ અંગેની મોજણીઓ અને નિવેદનોના આધારે છલાબેનને જાણવા મળ્યું કે આ મહિલાઓએ લારી થંભાવવા માટે પેદુના ભાગનો બ્રેક તરીકે ઉપયોગ કરવો પડતો હોવાથી તેમને અવાર-નવાર કસ્યુવાવડ થઈ જતી હતી. લારીના આડા દાંડાને કારણે તેમના પેદુ પર દબાણ આવતું હતું અને તેના કારણે કસ્યુવાવડ થતી હતી. તેમના આરોગ્ય અને પોષણની સ્થિતિ અત્યંત નબળી રહેતી હતી. એટલું જ નહીં, ગર્ભવતસ્થાના આખરી ગાળામાં પણ તેમણે ભારે શ્રમકાર્ય કરવું પડતું હતું. વળી, તેમને સાપ્તાહિક રજા, માંદળીની રજા કે કોઈ પણ પ્રકારનો દાક્તરી લાભ મળતો ન હતો. ‘માથોડા કામદાર’ જેવી અસંગઠિત મહિલા કામદારો માટે તો પ્રસૂતિના મળવાપાત્ર લાભ અને પ્રસૂતિકાળની રજાઓ દિવાસ્વાખ સમાન હતા અને આજે પણ તે જ સ્થિતિ પ્રવર્તે છે. છલાબેને ‘નેશનલ છન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન’ (અનાધાર)ને આ મહિલાઓ માટે વધુ સલામત લારી વિકસાવવાની ભલામણ કરી. સાથે જ, ‘નેશનલ છન્સ્ટીટ્યુટ ઓફ ઓક્યુપેશનલ ડેલ્ટ્ય’ (અનાધારાએ)ને શ્રમિકોની આરોગ્યની સ્થિતિનો અભ્યાસ કરવા માટે ભલામણ કરી. આમ, અનાધાર અને અનાધારાએ હાથ-લારી ખેંચનારા શ્રમિકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે તથા કસ્યુવાવડ અને અન્ય ઈજાઓ થતી અટકાવવા માટે પ્રથમ વખત સેવા સાથે હાથ મીલાવ્યા. રોજિંદી કામગીરી દરમિયાન મહિલાઓ વારેવાર અક્ષમાતાનો ભોગ બનતી હતી અને ઈજાગ્રસ્ત થતી હતી તે તરફ પણ છલાબેનનું ધ્યાન ગયું. તેમને ફરજિયાર થાય કે કોઈ વાહનની ટક્કરથી તેઓ અથડાઈને પડી જાય, તો આ મહિલાઓ કોણી મદદ માંગે? ‘ધ વર્કમેન્સ કમ્પેન્સેશન એકટ’ ડેઠળ આ

મહિલાઓને શ્રમિકો કે કામદારોના વર્ગમાં આવરી ન હોવાથી તેઓ વળતર માટે કોર્ટનું શરણ પણ લઈ શકે તેમ નહોતી.

તે સમયે છલાબેનને સુપાબાઈ સહિતની લાખો મહિલા શ્રમિકો સાથે થતા અન્યાય અને શોષણાની જાણ થઈ. છલાબેન ઘડી વખત કહે છે, સુપાબાઈને કારણે, ત્યાર પછી ચંદાબેન અને કરિમાબેનને કારણે મને વાસ્તવિકતાની અને ખાસ કરીને પુરણો પણ ન કરે તેવું જોખમી કાર્ય કરતી અસંગઠિત મહિલા શ્રમિકોએ કરવા પડતા સંઘર્ષની જાણ થઈ. અને આટલી આકરી મહેનત કરવા છતાં પણ તેમને તદ્દન નજીવું વળતર ચૂકવવામાં આવતું હતું. અસંગઠિત અર્થતંત્રની મહિલા શ્રમિકોના હક્કો માટે યુવા મહિલા વકીલ છલાબેન લડત ચલાવી રહ્યા હોવાના સમાચાર વાયુવેગે અમદાવાદમાં ફેલાઈ ગયા. ટ્રૂક સમયમાં જ સુપાબાઈ જેવાં અસંગઠિત મહિલા શ્રમિકોએ મજૂર મહાજન સમક્ષ સહાયની માગણી કરી તથા તેમની સાથે થતા અન્યાય અને શોષણાની રજૂઆત કરી. જૂનાં કપડાં વેચતાં ચંદાબેને મોટા વેપારીઓ અને નાણાં ધીરનારાઓ મૂડીની તાતી જરૂરિયાત ધરાવતા તેમના જેવા નાના ફરિયાઓનું કેવી રીતે શોષણા કરે છે તે છલાબેનને વર્ણાયું. ગોદાવરીબેન અને કરિમાબેન ધરે કામ કરતાં મહિલા શ્રમિકો હતાં અને અનુકૂમે બીડી વાળવાનું તથા ધાબળા અથવા ખોળમાં પેચવર્ક કરવાનું કમરતોડ કામ કરીને પેટિયું પણ માંડ રળી શકાય એટલું વેતન મેળવતાં હતાં. માણેક ચોકમાં શાકભાજી વેચનારાં લક્ષ્મીબેને જણાયું કે સ્યુનિસિપલ સત્તાતંત્ર અને પોલીસ સતત તેમને હેરાન કરતા અને તેમની પાસેથી લાંચ લેતા હતા.

ત્યાર પછી અસંગઠિત મહિલા કામદારોનું અલાયદું મંડળ રચવાનો નિર્ણય લેવાયો, કારણ કે આ શ્રમિકોનું કાર્યફલક કાપડ મિલના કામદારો કરતાં ઘણું જ લિન હતું. અને આ રીતે ‘સેવા’નો ઉદ્ભબ થયો. મિલ કામદારો દાયકાઓથી સંગઠિત થઈ ચૂક્યા છે. કપરો સંઘર્ષ વેઠિને તેમણે લઘુત્તમ વેતન, સાપ્તાહિક રજા, માંદળીની રજા સહિતના કલ્યાણકારી લાભો મેળવ્યા છે. અસંગઠિત મહિલા શ્રમિકોને આવા કોઈ લાભ મળ્યા નહોતા અને હજી પણ ગણ્યાગાંધ્યા લાભ જ પ્રાપ્ત થયા છે. સુપાબાઈ, ચંદાબેન, કરિમાબેન અને અમુક હજાર અન્ય મહિલાઓ અમારા મંડળની પ્રથમ સત્યો બની. અને સાબરમતી નદીના કાંઠે આવેલા ‘લોકમાન્ય તિલક’ બગીચામાં આવેલા લીમડાના એક જાડની નીચે ‘સેવા’નો જન્મ થયો. ઉલ્લેખનીય છે કે આ સ્થળ કોચરબ આશ્રમની નજીકમાં જ આવેલું છે, જ્યાં દક્ષિણ આફિકાથી પરત ફરીને ગાંધીજીએ રોકાણ કર્યું હતું. ચંપારણ સત્યાગ્રહના થોડા સમય બાદ, 17મી જૂન, 1917ના રોજ સ્થપાયેલો સાબરમતી આશ્રમ ત્યાંથી થોડા અંતરે આવેલો છે. મોટા ભાગની સ્વ-રોજગારી ધરાવતી મહિલાઓ પણ નોકરીદાતા-કર્મચારીનો નિશ્ચિયત સંબંધ ન ધરાવતી કેટલીક મહિલા શ્રમિકોનું મંડળ સ્થાપવાનો આ લાંબો સંઘર્ષ બની રહ્યો. શ્રમ વિભાગના કર્મચારીઓ આ મહિલાઓ

તેમના આગવા હક્કો ધરાવે છે તે માનવા માટે તૈયાર નહોતા. વળી, જાતિ (લિંગ)નું પાસું પણ તેમાં ભાગ ભજવતું હતું. શ્રમ કર્મચારીઓએ એવી દલીલ કરી કે બીડીઓ વાળવી અને સીવણકામ કરવું તે તો આ મહિલાઓનો ‘શોખ’ હતો! આખરે, અસંગઠિત શ્રમિકોની વ્યથાના પ્રત્યક્ષ બયાનોના કાળજીપૂર્વકના દસ્તાવેજુકરણ, નાના પાયે હાથ ધરાયેલા અભ્યાસો, ધૈર્ય અને ખંતને પગલે ધીમે-ધીમે શ્રમ કર્મચારીઓના વલણમાં પરિવર્તન આવ્યું. 12 એપ્રિલ, 1972ના રોજ, દેશના, અને કદાચ વિશ્વના પ્રથમ અસંગઠિત મહિલા શ્રમિકોના મંડળ તરીકે ‘સેવા’ની નાંદણી થઈ.

## માણેક ચોક સત્યાગ્રહ

1982માં માણેક ચોકના ફેરિયાઓ તથા લારીવાળાઓનો સંઘર્ષ એ ‘સેવા’નો બીજો સત્યાગ્રહ હતો. માણેક ચોકમાં શાકભાજી વેચનારા શ્રમિકોના પ્રતિનિધિ તરીકે લક્ષ્મીબેને અને દિલ્હી ચક્કા તથા ગ્રાદરવાજામાં જૂનાં કપડાં વેચનારાં શ્રમિકોના પ્રતિનિધિ તરીકે ચંદાબેને છલાબેનને બજારમાં તેમને નડતી મુશ્કેલીઓ જણાવી. લક્ષ્મીબેન સહિતનાં શ્રમિકો પેઢીઓથી શાકભાજી વેચતાં હતાં. માણેક ચોકના બજારમાં ટ્રાફિક વધ્યો, તે સાથે જ શાકભાજી વેચનારાં શ્રમિકો ‘નડતરરૂપ’ લાગવા માંડ્યાં. પોલીસ અને ભૂનિ. કોર્પોરેશનના અધિકારીઓ નિયમિતપણે તેમને ત્યાંથી ખસેડવા માંડ્યા. ચંદાબેન સહિતનાં જૂના કાપડના ફેરિયાઓ સાથે પણ આમ જ થયું. એક પોલીસકર્મીએ તો ફેરિયાઓ પાસેથી તેણે નિયમિતપણે જપ કરેલી (હપ્તા સ્વરૂપે પડાવેલી) શાકભાજીમાંથી નાની ખાણીપીણીની દુકાન પણ ખોલી હતી. ફેરિયાઓ બજારમાં પાથરણાં રાખી શકે અને સામાન વેચી શકે તે બદલ તેમની પાસેથી લાંચ લેવી જાણો નિયમ બની ગયો હતો. લક્ષ્મીબેન અને છલાબેન આ સમસ્યામાંથી માર્ગ કાઢવાનું નક્કી કર્યું. તેમણે પોલીસ અને ભૂનિસિપાલિટી સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું કંઈ પરિણામ ન આવતાં તેમણે સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો. માણેક ચોકના બજારના વ્યસ્ત માર્ગ પર તેઓ સૂર્ય ગયા અને તેમણે પોલીસ અને ભૂનિસિપાલિટીને તેમને ત્યાંથી હટાવવાનો પડકાર ફેંક્યો. એવી દલીલ કરી કે તેમને તેમની રોજીરોટીનું રક્ષણ કરવાનો અધિકાર છે. ‘માથોડા કામદાર’ હડતાળની માફક આ સત્યાગ્રહ પણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો. વાટાધારો શરૂ થઈ, પણ તે લાંબી ન ચાલી. આખરે, ‘સેવા’એ દેશની સર્વોચ્ચ અદાલતનું શરણ લીધું અને પિટીશન દાખલ કરી. લક્ષ્મીબેન, શાંતાબેન અને છલાબેન તેમનાં વડીલ, યુવાન હન્દિરા જ્યાસ્ટિંગ સાથે કોર્ટમાં હાજર થવા માટે દિલ્હી ગયા. આજે વર્ષો બાદ, કોર્ટના કારકૂનોના આશ્ર્યર્થમાં ગરકાવ ચહેરાઓને યાદ કરીને લક્ષ્મીબેન કહે છે, તેઓએ સુપ્રીમ કોર્ટમાં કદી પણ અમારા જેવી મહિલાઓ જોઈ નહોતો! ન્યાયાધિશ પણ અમને જોઈને અચંબિત થઈ ગયા હતા, પણ તેમણે ધીરજપૂર્વક અમારી વાત સાંભળી હતી. આખરે, અમે એ કેસ જીતી ગયા હતા. વૈકલ્પિક સ્થળની વ્યવસ્થા

ઉત્તી કરવામાં આવે, તો જ અમને ત્યાંથી ખસેડવા, તે સિવાય નહીં - તેવો ચુકાદો આવ્યો. તે અમારી મોટી જીત!

માણેક ચોક સત્યાગ્રહ અને સુપ્રીમ કોર્ટનો કેસ આ પ્રકારનાં પ્રથમ ઉદાહરણો હોવાની સાથે-સાથે તે ફેરિયાઓના ભાવિ સંઘર્ષ માટે સીમાચિલ્લરૂપ બની રહ્યો. તેને પગલે દેશભરમાં ફેરિયાઓ અને તેમની કાર્ય-સ્થિતિના સર્વે હાથ ધરવામાં આવ્યા. ફેરિયાઓની વિગતો અને વ્યથાના પ્રત્યક્ષ બયાનોને પગલે અંતે ‘નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્ઝ ઓફ ઇન્ડિયા’ (એનાંએસવીઆઇ) અને પછીથી તમામ બંડોમાં ફેરિયાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન ‘સ્ટ્રીટનેટ’ની સ્થાપના થઈ. 40 વર્ષ કરતાં પણ લાંબા સમયગાળાના સંઘર્ષ, કોર્ટ કેસ, ધરણાં અને સત્યાગ્રહો પછી ફેરિયાઓને 2014માં કાયદાનું પીઠબળ મળ્યું. ચંપારણ સત્યાગ્રહની માફક માણેક ચોક સત્યાગ્રહ ફેરિયાઓની ન્યાયની લડત માટે નિર્ણયિક બની રહ્યો. માણેક ચોક સત્યાગ્રહને પગલે ‘ડર્બન’, ‘દક્ષિણ આફ્ઝિકા’, ધાનાના ‘આકા’ અને લિમાના ‘પેરુ’ સહિતનાં સ્થળોએ આ પ્રકારની ચળવળોને વેગ મળ્યો.

## ‘સેવા’નો ખેડા સત્યાગ્રહ

આપણી આજાદીની ચળવળના હતિહાસમાં ખેડાનું સ્થાન હંમેશા વિશેષ રહ્યું છે. તે જ રીતે, સેવાના હતિહાસમાં પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે. કદાચ, તેનું કારણ ત્યાંથી પસાર થતી સિંચાઈની કેનાલ છે, જે બેતી માટે એકદમ સાનુકૂળ છે અને સાથે જ ત્યાં નાના અને મોટા ખેડૂતો પણ વસે છે. ઇ.સ. 1918માં, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા રવિ શંકર વ્યાસ, નરહરિ પરીખ અને મોહનલાલ પંડ્યા સહિતના સ્થાનિક નેતાઓએ ખેડા સત્યાગ્રહની આગેવાની લીધી. તે સમયે દુકાણ પદ્ધતો હોવા છતાં લાદવામાં આવેલા કરવેરાના વિરોધમાં તેમણે ખેડૂતોને સંગઠિત કર્યા હતા.

‘સેવા’ના હતિહાસમાં ખેડાનું પ્રકારણ ‘સેવાના વધુ એક રાજકુમાર શુક્કલા’ - ઇન્દ્રિયા મેકવાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ તે જિલ્લાના જમીનદારના તમાકુનાં ખેતરોમાં અને પછીથી ‘ખળી’ તરીકે ઓળખાતા તેના પ્રોસેસિંગ યુનિટ્સમાં મજૂરી કરતાં હતાં. ઇન્દ્રિયાબેન અમદાવાદના કરારબદ્ધ શ્રમિકો અને ‘સેવા’ના તમામ સભ્યોના મજૂરૂત અને નિડર સંગઠક હતાં. હવે તેઓ તેમના વતન ચિખોડામાં મહિલાઓને સંગઠિત કરવા ઉત્સુક હતાં. તેમણે છલાબેનને તમાકુના શ્રમિકો સાથે થતા અન્યાય વિશે વાત કરી. આ શ્રમિકોમાં મોટા ભાગની મહિલાઓ હતી. તેમને આવશ્યક લઘુતમ વેતન ચૂકવવામાં આવતું હતું. વળી, આ મહિલા શ્રમિકોએ તેમનાં નાનાં બાળકોને ખેતરો અને ફેકટરીઓમાં સાથે લઈ જવાં પડતાં હતાં. આ બાળકો જેરી નિકોટિન અને તમાકુના જોખમી રજકુણોના સંપર્કમાં આવતાં હતાં. એટલું જ નહીં, કાર્ય સ્થળે નાનાં બાળકો માટે

ઘોડિયાધરની પણ સુવિધા નહોતી. મોટા બેઢૂતો અને ‘ખળી’ માલિકોના માણસો દ્વારા જાતીય શોષણ અને પજવણી થતી હોવાની વાતો પણ વહેતી હતી.

ચંપારણ સત્યાગ્રહ અને ‘સેવા’ના અગાઉના સંઘર્ષોમાં અમલમાં મૂકવામાં આવેલી વ્યુહરચનાઓનો અભ્યાસ કરીને સેવાના તત્કાલિન સચિવ રેનાના જહાબવાલાએ છન્દિરાબેન સાથે સ્વયં જઈને કામદારોની સ્થિતિનો તાગ મેળવો હતો. યુવાન સંગઠક તરીકે હું પણ તેમની સાથે ગઈ હતી અને કામદારો સાથેની બેઠકમાં હાજર રહી હતી. અમારી સાથે બેસીને ચર્ચા કરવાથી તેમને કામ ગુમાવવાનો ભય સત્તાવતો હતો. વળી, અન્યાય વિરુદ્ધ સંગઠિત થવાની હાકલ કરતી બહારની અજાણી વ્યક્તિ પર તેઓ કેવી રીતે ભરોસો મૂકી શકે? છન્દિરાબેન તેમના જ સમૃદ્ધયના હોવા છતાંથે શ્રમિકો ફૂકી-ફૂકીને પગલું ભરતા હતા. મને આજે પણ તેમના શબ્દો યાદ છે: ‘જો અમે સંગઠિત થઈને અમારું મંડળ રચીએ, તો અમારાં બાળકોનું પેટ કોણ ભરશે? અમારી પાસે હાલમાં જે રોજગારી છે, તે પણ છિનવાઈ જશે’.

અમે તેમની કાર્ય સ્થિતિનો તેમજ તેમની જરૂરિયાતોનો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું. તેમાં, બાળકોની કાળજી એ સર્વોચ્ચ પ્રાથમિકતા જણાઈ. મને છન્દિરાબેન સાથે મળીને શ્રમિકોનાં નાનાં બાળકો માટે ઘોડિયાધર તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. અમે આ કાર્ય શરૂ કરીએ અને કેટલીક પ્રાથમિક આરોગ્ય સેવાઓ પણ શરૂ કરીએ તે માટે મહિલાઓમાં ઉત્સુકતા જોવા મળી. તમાકુના રજકણોને કારણે તેમને સતત ખાંસી રહેતી અને શાસોચ્છવાસને લગતી સમયા રહેતી. વળી, નિકોટિનની આડઅસરરૂપે તેમને ભૂખ ન લાગવી, ચક્કર આવવા, માસિક ચકમાં વિક્ષેપ ઊભો થવો વગેરે જેવી શારીરિક તકલીફો રહેતી હતી. અમે કેટલાક કામદારોને તેમના ગામના આરોગ્ય કાર્યકર્તા તરીકેની તાલીમ આપવાનું શરૂ કર્યું. તે પૈકીના કેટલાક લોકો આગળ જતાં નિડર સત્યાગ્રહી તરીકે ઊભરી આવ્યા.

ફરી એક વાર, ગાંધીજીના ચંપારણના અનુભવો અને પણીથી અમદાવાદ કાપડ-મિલોના કામદારોની હડતાળના અનુભવોમાંથી શીખ મેળવીને અમે તમાકુ શ્રમિકો માટે ઘોડિયાધર તૈયાર કરવાની કામગીરી હાથ ધરી. સુમનબેન અને શારદાબેન બંને તમાકુ શ્રમિકો હતાં. તે ઘોડિયાધરનાં પ્રથમ શિક્ષિકા (તાલીમકર્તા) બન્યાં. તેમણે કેન્દ્રો ચ્યાલ્વાવા માટેની અને નાનાં બાળકોની સર્વાંગી કાળજી રાખવા માટેની તાલીમમાં હોશભેર ભાગ લીધો. ચિખોડામાં એક ઘોડિયાધર ઊભું કર્યા બાદ અમે આજુબાજુનાં ગામોમાં પણ ઘોડિયાધર બાંધ્યાં. બાળકો માટેના ખોરાક, રમકડાં તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓની સહાય મેળવવા માટે અમે જમીનદારો અને ‘ખળી’ માલિકોનો સંપર્ક સાધ્યો. અમારા આશ્રય વર્ચ્યે તેમણે ઘોડિયાધરને સહાય પૂરી પાડવાની તૈયારી

દર્શાવી. પણ સાથે-સાથે એવી તાકીદ પણ કરી કે, બાળકો માટે અમે ચોક્કસ તમને સહાય પૂરી પાડીશું, પણ હવે લઘુતમ વળતરની માગણી ન કરતા!

ઘોડિયાધરોને પગલે બેડા તમાકુ કામદારો અને અમારી અમદાવાદ સ્થિત તેમના સહકાર્યકરો વર્ચ્યે લાગણીનો સંબંધ પ્રસ્થાપિત થયો. આ પાછળનું કારણ કદાચ એ હતું કે તેમણે તેમની મહામૂલી મૂડીસમાન તેમનાં બાળકો અમને સૌંચાં હતાં. સાથે જ, આ સેવા તેમને ઘણી ઉપયોગી નીવડી હતી. અમે તેમની જરૂરિયાતો અને ઘોડિયાધરની અસરકારકતાનો અભ્યાસ કર્યો. તેના તારણરૂપે જાણવા મળ્યું કે ગરીબી સામેની લડતમાં તથા સ્વ-નિર્ભરતા માટે આ અગત્યની સેવા હતી. મહિલાઓ કોઈ પણ પ્રકારના ઉચ્ચાટ કે ચિંતા વિના રોજગારી મેળવવા માટે બહાર જઈ શકતી હતી. હવે તે મહિલાઓ માનસિક શાંતિ અનુભવતી હતી. નાનાં બાળકોને સેવા ઘોડિયાધરમાં મૂકવામાં આવ્યાં, ત્યાર પછી 70 ટકા મોટાં ભાઈ-બહેનો, ખાસ કરીને છોકરીઓ પહેલી વાર શાળાએ ગઈ. આ સિવાય પણ ઘણા ફાયદા થયા, જેમ કે, આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધારો નોંધાયો, શિક્ષણ મેળવવાનો આનંદપ્રદ અનુભવ થયો અને બાળકો શાળાએ જઈ શક્યાં.

વળી, શ્રમિકોને પણ ધીમે-ધીમે સંગઠનની તાકાત અને તેમની સાથે થતા અન્યાય સામે લડત ચલાવવા માટે સામૂહિક પગલાં કેટલા જરૂરી છે તેની જાણ થઈ. તેમણે જોયું કે સામૂહિક સ્તરે તેમની ખરીદ શક્તિ વધે છે અને લઘુતમ વેતન તથા અન્ય લાભોની માગણીઓ વધુ અસરકારકતા ઊભી કરે છે. મારા મતે, ઘોડિયાધર, પ્રાથમિક આરોગ્ય સેવા અને આગળ જતાં સ્વ-સહાય જૂથો (એસએચ્યેચ્યુ)ની રચના મંડળને સંગઠિત કરવા માટેનાં ચાવીરૂપ પરિબળો બની રહ્યાં. તેના કારણે પરસ્પર વિશ્વાસ પ્રસ્થાપિત થયો અને અન્યાયનો સામનો કરવા તેઓ સક્ષમ છે તેવા આત્મવિશ્વાસનો સંચાર થયો. બેડાની ઘણી બહેનોએ ‘સેવા’ના બેડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. રાસનોલ ગામમાં, 1995માં મંડળની કામગીરી બાદ ‘ખળી’ માલિકોએ લેબર ઇન્સ્પેક્ટરની સામે કામદારોને લઘુતમ વેતન આપ્યું. પરંતુ, પણીથી તેમણે મહિલાઓને ‘ખળી’ના પાછલા બારણોથી તે રકમ પરત કરી દેવાની તાકીદ કરી! જે માતાઓનાં બાળકોની ઘોડિયાધરમાં સંભાળ લેવામાં આવતી હતી, તે માતાઓની આગેવાની ડેણ કામદારોએ જમીનદારોની આ માગણીનો ઇનકાર કર્યો. તેમણે લડત આદરી અને ‘ખળી’ની બહાર ધરણાં કર્યા. શ્રમિકોનું આ સાહસ જોઈને ખળીના માલિકોને આંચકો લાગ્યો. તેમણે મદદ માટે અન્ય ખળી માલિકોનો સંપર્ક સાધ્યો. ‘સેવા’ની સંગઠનાત્મક પ્રવૃત્તિઓના વળતા જવાબરૂપે ખળી માલિકોનું સંગઠન અગાઉથી જ રચવામાં આવ્યું હતું. સંગઠનના આગેવાનો રાસનોલ ધસી આવ્યા. તે સમયે શ્રમિકોમાં એવી ટીખળ વહેતી થઈ કે તેમણે

તેમના ગામમાં ક્યારેય કારનો આટલો મોટો કાફલો નથી જોયો! મહિલાઓ મક્કમ રહી અને તેમણે સત્યાગ્રહ ચાલુ રાખ્યો, એકમેકને હિંમત આપવાનું ચાલુ રાખ્યું. આખરે, જિલ્લા વહીવટીતંત્રએ દરમિયાનગીરી કરી અને મહિલાઓએ તેમને ચુકવાયેલું વેતન તેમની પાસે રાખ્યું.

તે દિવસથી, ખળી માલિકો અને અમારી વચ્ચેની સ્થિતિ બદલાઈ ગઈ. હવે તેઓ વાટાધાર કરવા માટે તત્પર રહેતા, ઘોડિયાધરમાં ઉદાર હાથે યોગદાન આપતા, આ પહેલની પ્રશંસા કરતા અને હવે ચર્ચા કરવા માટે મોકળી તકો મળી રહેતી. તમાકુની ભાગ ઘટતાં તેમણે કેળાં અને બટાકા જેવા પાક લેવાનું શરૂ કર્યું. દરમિયાન, હવે મહિલાઓ આજીવિકા માટે ફક્ત જમીનદારો કે ખળી માલિકો પર નિર્ભર નહોતી. હવે તેમણે એસએચજાનું મજબૂત સંગઠન ઊભું કર્યું હતું. જેના થકી તેઓ બચત કરતી હતી, બિયારણ બરીદવા માટે લોન મેળવી શકતી હતી અને તેમની નાની જમીન પર ખેતી કરી શકતી હતી. કેટલીક મહિલાઓએ ફરીથી વણાટકામનું કાર્ય શરૂ કર્યું અને તેમના સ્વયંના એકમની રચના કરી. ‘સેવા’એ તેમને હેન્ડલ્બુમ કોર્પોરેશનમાંથી યાર્ન મેળવવામાં મદદ કરી. સાળ માટે તેમણે લોન લીધી અથવા તો તેમની બચતનો ઉપયોગ કર્યો. અમારાં ઘોડિયાધરોમાં જેમની કાળજી-સંભાળ લેવામાં આવતાં હતાં તેવી તમાકુ શ્રમિકોની દીકરીઓ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની કારકિર્દી ધરાવે છે. ‘સેવા’ના ખેડા સત્યાગ્રહ અન્યાય અને શોષણ સામે લડત ચલાવવા માટે નવો ચીલો ચાતર્યો. અને તે માટે વૈકલ્પિક રોજગારી અને વ્યવસાય વિકસાવવાં, કૌશલ્ય વર્ધન માટે ભાગીદારીનું સર્જન કરવું, શિશુ સંભાળ, આરોગ્ય કાળજી જેવી સામાજિક સુરક્ષા અને મહિલાઓ માટે સૂક્ષ્મ ધિરાણ જેવા માર્ગો અપનાવ્યા. ખેડાના બચત અને ધિરાણ સંગઠન સાથે હજારો સભ્યો જોડાયેલા છે અને સામૂહિક બચતની રકમ કરોડોએ પહોંચી છે. લોનને પગલે સંગઠનનું વિસ્તરણ થાય છે, પરિણામે સંગઠન અને મંડળ બંને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરે છે. ઘોડિયાધરનાં શિક્ષકો (તાલીમકર્તાઓ) અને માતાઓની સહકારી મંડળી કાર્યરત છે, જે બાળકોની કાળજીને લગતી સેવાઓ અને નાનાં બાળકો તથા હવે પુખ્તાને પણ પોષણયુક્ત આહારની સેવા પૂરી પાડે છે. બચત અને ધિરાણ સંગઠન સાથે જી, સ્વસહાયનો આ સફળ પ્રયત્ન છે. આ રીતે, અમારા ખેડા સત્યાગ્રહમાં સંધર્ષ અને વિકસની સ્થિતિમાં છિવાડાના ગરીબ અને સૌથી વંચિત વ્યક્તિને પ્રાથમિકતા આપવાના ગાંધીજીના વિચારોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા.

## વિજ્ઞાન ભવન સત્યાગ્રહ

અસંગઠિત કામદારો, ખાસ કરીને મહિલાઓએ વેઠવો પડતો સૌથી મોટો અન્યાય એ છે કે તેમના કાર્ય અને યોગદાનને માન્યતા આપવામાં આવતી નથી. મુખ્ય પ્રવાહની મજૂર ચણવળમાં અસંગઠિત મહિલા

કામદારોને સંગઠિત કરવાનું મહત્વ મોહું-મોહું સમજાયું હતું. મહિલાઓનું કાર્ય-ફલક ઘણું જુદું હોવાને કારણો આ સ્વાભાવિક હતું. અનુભવી શ્રમિક સંગઠકોને પણ મહિલાઓનું કાર્ય, તેમને થતી ચુકવણી અને તેમને સંગઠિત કરવાના પ્રયત્નો વગેરે પાસાંઓનું મહત્વ મોહું સમજાયું હતું. તેમાંથી વિવિધ શ્રમ મંડળો અને સામૂહિક મંચોમાંથી ‘સેવા’ના અને અમારા સભ્યોને બાકાત રાખવામાં આવ્યાં, તે પરિસ્થિતિ મુશ્કેલીભરી બની રહી. આવો જ એક મંચ હતો ‘ઇન્ડિયન લેબર કોન્ફરન્સ’ (આઇએલસી). તે ત્રિપક્ષી ફોરમ હતી, જેનું આયોજન દર વર્ષે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે થાય છે. મંડળો અને તેમના પ્રતિનિધિઓ, નોકરીદાતાઓ અને તેમના પ્રતિનિધિઓ તથા સરકારના શ્રમ અધિકારીઓ ત્યાં એકત્રિત થાય છે અને સમાન કાર્ય મુદ્દાઓ શોધવાનો પ્રયત્ન કરે છે. ‘સેવા’એ આઇએલસીને ઉપરોક્ત ફોરમમાં સહભાગી થઈને ચર્ચા તથા બેઠકમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો. અસંગઠિત મહિલા કામદારોના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને યોજવામાં આવતી આ ફોરમમાં સામેલ થવા માટે અમે ઉત્સુક હતા. અમે કોઈ પણ રીતે દિલ્હી જવાનો નિર્ધાર કર્યો. ‘સેવા’ના 25 કામદાર-નેતાઓની ચૂંટાયેલી સમગ્ર એક્ઝિક્યુટિવ કમિટી જાન્યુઆરી, 1995માં વિજ્ઞાન ભવન પહોંચ્યી. અમને આશા હતી કે ચર્ચા-વિચારણામાં અમને જરૂર આમંત્રિત કરવામાં આવશે. શ્રમિક આગેવાનો, નોકરીદાતાઓ અને સરકારી અધિકારીઓને અમે પરિસરની અંદર પ્રવેશતાં જોયાં, જ્યારે અમે પ્રવેશની પરવાનગી મળે તેની રાહ જોતાં બહાર ઊભાં રહ્યાં. જ્યારે અમને સમજાઈ ગયું કે અમને અંદર પ્રવેશવા નહીં દેવાય, ત્યારે અમે વિજ્ઞાન ભવનની બહારની ફૂટપાથ પર ધરણાં કર્યા. ગાંધીજીની શીખ પ્રમાણો અમે અમારી સર્વ ધર્મ પ્રાર્થના કરી અને જુસ્સો ટકાવી રાખવા માટે ગીતો ગાવાનું ચાલુ રાખ્યું. છેવટે પોલીસ આવી અને અમારી ધરપકડ કરીને અમને નજીકના પોલીસ સ્ટેશને લઈ ગઈ. અમે ગાતાં રહ્યાં અને એકતાનાં સૂત્રો પોકારતાં રહ્યાં - ‘હમ સભ એક હૈ! સેવા સંગઠન જિંદબાદ! અમારો ઉદેશ્ય જાણીને પોલીસે સહાનુભૂતિ વ્યક્ત કરી અને અમને ચા પીવડાવી! અમે ગાંધીજીએ વર્ષો પહેલાં કહેલાં સાત વચ્ચેનોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી - જેમાં સત્ય, અહિસા, સર્વર્ધમ, સ્વદેશી અને નિરદ રહેવા સહિતનાં વચ્ચોનો સમાવેશ થાય છે.

સત્યાગ્રહ કર્યો હોવા છતાં પણ તે વર્ષ અમને ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં આમંત્રણ ન મળ્યું. તે પછી અમે દેશમાં અસંગઠિત મહિલા કામદારોના સૌથી વિશાળ પ્રાથમિક મંડળ તરીકે પ્રવેશની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો. આ દરમિયાન અમે સંગઠિત થઈને અમારી ચળવળને વધુ મજબૂત કરી અને ખેતી, બાંધકામ વગેરે જેવાં અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોમાં દેશના 14 રાજ્યોમાં 20 લાખ સભ્યો ધરાવતું રાખ્યો સંગઠન બન્યું. એક વખત સંગઠને અમુક રાજ્યોમાં તથા મહત્વનાં ક્ષેત્રોની પાંચ લાખની સભ્યાનો આંક

પાર કર્યો, તે પછી અમને રાષ્ટ્રીય મંડળ તરીકે સ્વીકૃતી મળી અને ઈન્ડિયન લેબર કોન્ફરન્સ તથા અન્ય મંચોમાં સામેલ થવાનો સંપૂર્ણ હક્ક મળ્યો. લાંબા સમય પછી અસંગઠિત મહિલા કામદારોનું મંડળ ‘સેવા’ દેશની મુખ્ય પ્રવાહની શ્રમિક ચળવળમાં પ્રવેશયું અને તેણે અસંગઠિત કામદારોને સંગઠિત કરવાના તેના અનુભવો તથા ઉપાયો ચાવીરૂપ રાષ્ટ્રીય શ્રમ મંચ ‘ઈન્ડિયન લેબર કોન્ફરન્સ’ સમક્ષ વર્ઝાયા તથા તેમની માગણીઓ અને પ્રશ્નોની રજૂઆત કરી.

## ચંપારણ સત્યાગ્રહનું પુર્નલોકન અને બોધપાઠ

હાલના સમયે ચંપારણ સત્યાગ્રહના ઇતિહાસનું પુર્નલોકન કરવાનું અને તેના બોધપાઠોને આપણાં રોઝિંદા જીવન સાથે વણી લેવાની તાતી જરૂર છે. ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી છે અને અમે આપણાં તમામ નાગરિકોને, ખાસ કરીને મહિલાઓને દેશના અર્થતંત્ર અને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવી નથી શક્યાં. અસંગઠિત અર્થતંત્રમાં સમાવિષ્ટ અને આપણાં 93 ટકા કાર્યબળ ધરાવતા કામ કરનારો ગરીબ વર્ગ, ખાસ કરીને દખિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને અન્ય જ્ઞાતિઓ તથા સમુદ્દ્રાયો સામાજિક સુરક્ષાની સાથે કાર્ય અને આવકની સુરક્ષા પણ નથી ધરાવતા. મહિલા કામદારો અત્યંત ગરીબ અને સૌથી વધુ શોષણભરી સ્થિતિ ધરાવે છે. ‘સેવા’એ તેની કામગીરી શરૂ કરી, ત્યારે, 40 વર્ષ કરતાં પણ વધુ સમયગાળા અગાઉ મહિલા શ્રમિકોની કામગીરીને માન્યતા આપી હતી.

ગાંધીજીએ આપણને ‘દૂસરી આજાદી’ ગરીબી અને ભૂખમરાથી આજાદી મેળવવા માટેના પ્રયત્નો કરવાની ભવામણ કરી હતી. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી આપણો ખેડેલી લાંબી મજલની યાદ અપાવે છે, અને સાથે જ હજુ ઘણાં કાર્યો પૂર્ણ કરવાનાં છે તેની યાદ અપાવે છે. ગળીના ખેડૂતોનું શોષણ થતું હતું તે ભૂતકાળની વાત છે. પણ, નાના અને સીમાંત ખેડૂતો તથા જમીનવિહોણા ખેતમજૂરો પોતાના જ દેશબંધુઓના હાથે અન્યાય અને શોષણનો ભોગ બની રહ્યા છે. રોજેરોજ દેશભરમાં થતા નાના-મોટા સત્યાગ્રહો આપણને ચંપારણ સત્યાગ્રહની યાદ અપાવે છે, પછી તે વિવિધ રાજ્યોમાં ખાણકામના વિરોધમાં ન્યામગિરી અને સ્થાનિક આદિવાસીઓનો સંઘર્ષ હોય, ટ્રોલેર્સ (માછલી પકડવાની મોટી જાળવાળી હોડી) સામે વિરોધ નોંધાવીને આજીવિકાના પોતાના હક્ક માટે લડતા માછીમારો હોય કે ખેતીની ઊપજના ભાવોને નિયંત્રિત કરતા વચ્ચેટિયાઓની દખલગીરી અટકાવવા માંગતા ખેડૂતો હોય.

‘સેવા’ ખાતે અમે ચંપારણ સત્યાગ્રહ તથા ગાંધીજીની આગેવાની ડેટાનાં અન્ય અંદોલનોમાંથી મળેલો બોધપાઠ આત્મસાત્ર કર્યો છે. ગાંધીજીના કેટલાક અભિગમો અને વ્યૂહરચનાઓ હવે ‘સેવા’ના સિદ્ધાન્તો સાથે ગાઢપણે વણાઈ ચુક્યા છે. સૌપ્રથમ અમે સંગઠિત

કરવાની અમારી કામગીરી અને સત્યાગ્રહો પણ સર્વે, જીથ ચર્ચા, રૂબરૂ મુલાકાતો વગેરે પદ્ધતિઓ દ્વારા ઊંડાણપૂર્વક તથ્યો પ્રાપ્ત કરીને હાથ ધર્યા હતા. ગાંધીજીની શીખ પ્રમાણો, અમારા દરેક પ્રયત્નમાં અમારા સત્યો કેન્દ્રસ્થાને હોય છે. અમે તેમની સમસ્યાઓ, તેમની માગણીઓ અને તેમની જરૂરિયાતો ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. સેવાના તમામ સંધર્ષોના ઇતિહાસમાં સર્વે, માહિતી અને માહિતી એકત્રીકરણ ધણા મહત્વપૂર્ણ રહ્યા છે.

વર્ષો પહેલાં જ્યારે શ્રમ વિભાગ પાસે પણ બીરીના કામદારોના આંકડાઓ નહોતા અને તેમણે એવી દલીલ કરી હતી કે આવા શ્રમિકોની સંખ્યા એટલી બધી નથી કે તેમના માટે ખાસ કલ્યાણકારી યોજનાઓ ઘડવામાં આવે, ત્યારે સેવા પાસે તમામ પુરાવા મોજૂદ હતા. અસંગઠિત મહિલાઓ માટે સ્થાનિક, જિલ્લાકીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સ્થાનિક સ્તરે અડયણરૂપ બનતો ‘આંકડાકીય માહિતીનો અભાવ’ દૂર કરવા માટે પ્રાપ્ત કરવામાં આવેલી પ્રમાણભૂત માહિતી શક્તિશાળી સાધન બન્યું છે. માથોડા કામદાર, માણોક ચોકના ફેરિયા, ખેડાના તમાકુ કામદારો હોય કે પછી વિજ્ઞાન ભવનની બહાર ઈન્ડિયન લેબર કોન્ફરન્સમાં પ્રવેશ મેળવવાનો સત્યાગ્રહ હોય, અન્યાય સામે લડત ચલાવવા માટે ચોગ્ય વ્યૂહરચનાઓ વિકસાવવામાં અને સ્થાનિક વાસ્તવિકતાઓની સમજ મેળવવા માટે સ્થાનિક સ્તરના પુરાવા ધણા ઉપયોગી નીવડ્યા છે.

બીજું, અમે હંમેશા અમારા સત્યોના અભિગ્રાયો સાંભળવાનો, તેમની માગણીઓ અને તેમની જરૂરિયાતો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ અમારા માર્ગદર્શક છે. વર્ષો વીતવાની સાથે અમે અમારા સત્યો પાસેથી જાણકારી મેળવવાની બહુવિધ તકોનું સર્જન કર્યું છે અને તેમની જરૂરિયાતો અને માગણીઓ અનુસાર યોજનાઓ, કાર્યક્રમો અને અભિયાનો વિકસાયાં છે. ત્યાર બાદ સ્થાનિક સ્તરે કામદારોની આગેવાની ઊભી કરવી એ મહિલાઓને સંગઠિત કરવા માટેના અમારા અભિગમનું અન્ય એક ચાવીરૂપ પાસું છે. હજારો મહિલાઓ જે રીતે તેમનાં ગામો અને સમુદ્દ્રાયોની સક્ષમ, સમાવેશક અને હિંમતવાન આગેવાન બની તે ‘સેવા’નાં કાર્યોનું સૌથી સંતોષજનક પાસું છે. તે પૈકીની ઘણી મહિલાઓ પંચાયતો, વિલેજ હેલ્પ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી (વીએચએસએન્સી), મહિલા આરોગ્ય સમિતિઓ (અમઅએએસ) અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસઅમ્બીસી)માં ચૂંટાઈ છે.

એક દાયક કરતાં પણ વધુ સમયથી ‘સેવા’ની એક્ઝિક્યુટિવ કમિટી ભારતમાં અસંગઠિત કામદારોની ચળવળની આગેવાની લઈ રહી છે. આ કમિટી ચુંટાયેલી કાર્યકર મહિલાઓની બનેલી છે. ‘સેવા’નાં જનરલ સેકેટરી, જ્યોતિ મેકવાન - જે તમાકુ કામદાર અને ખેડા જિલ્લામાં પ્રથમ વાર મહિલાઓને સંગઠિત કરનાર અને આગળ

જતાં સત્યાગ્રહની આગેવાની કરનાર ઇન્દ્રાબેનનાં પુત્રી છે. તે જ રીતે, મહિલા કાર્યકરોના બોર્ડના ચૂંટાયેલાં સભ્યો ‘સેવા’ દ્વારા રચવામાં આવેલી 100થી વધુ સહકારી મંડળીઓની આગેવાની લઈ રહ્યાં છે. આ સહકારી મંડળીઓનો ઉપયોગ અને તેનું વ્યવસ્થાપન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. એટલું જ નહીં, સામૂહિક ઉદ્યોગોની માલિક પણ તેઓ જ હોય છે.

ત્રીજું, અમે હંમેશા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા ઉપરાંત આરોગ્ય, શિશુ સંભાળ, શિક્ષણ, પાણી, સ્વચ્છતા અને નાણાંકીય સેવાઓ જેવાં ક્ષેત્રોમાં નક્કર કામગીરી હાથ ધરવા માટે મહિલાઓને સંગઠિત કરી છે. ગાંધીજી હંમેશા તેમના કાર્યકરો અને આશ્રમના રહેવાસીઓને આવી નક્કર કામગીરી કરવા માટે પ્રેરતા હતા. સંગઠિત કરવાના અમારા રોજિંદા અનુભવો થકી અમને તેનું મહત્વ પણ સમજાયું. અમે મંડળો અને સહકારી મંડળીઓ થકી સંવર્ષ અને વિકાસની અસરકારક વ્યૂહરચના અપનાવી. આ સંયુક્ત વ્યૂહરચના અસંગઠિત મહિલાઓની સહકારી મંડળીઓને સંગઠિત કરવામાં ઘણી જ અસરકારક બની રહી. એક તરફ વ્યાપક સંખ્યામાં મહિલાઓ અમારા મંડળમાં સંગઠિત થઈ છે, જેના કારણે તેમને સમૂહની શક્તિ, ખરીદશક્તિનો લાભ મળ્યો છે, તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે તેઓ સક્ષમ થયાં છે. તો બીજી તરફ, તેઓ સામૂહિક ઉદ્યોગ - સહકારી મંડળીઓ ધરાવે છે - જેના થકી તેમને આળવિકાના વૈકલ્પિક સોતો મળી રહે છે. વધુમાં, સહકારી મંડળીઓમાં મહિલાઓ જ તેમના ઉદ્યોગની વપરાશકર્તાઓ, માલિકો અને વ્યવસ્થાપકો હોય છે. રોજગારી મેળવવા માટે તેમણે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડતું નથી. સહકારી મંડળીઓ સ્થાનિક સ્તરે રોજગારીની તક ઊભી કરતી હોવાની સાથે-સાથે તે લોકશાહીની, નેતૃત્વની, સામૂહિક ધોરણો તટસ્થ તથા સૈદ્ધાન્તિક રીતે વ્યવસાયનું વ્યવસ્થાપન કરવા માટેના નવા અને સર્જનાત્મક માર્ગોની પ્રયોગશાળા છે.

ચોથું, મહિલા કામદારોને સંગઠિત કરવાનો, સામાજિક સુરક્ષા અને આર્થિક સેવાઓ સાથે તેમના માટે વૈકલ્પિક રોજગારી ઊભી કરવાનો અમારો સાકલ્યવાદી અભિગમ પણ સ્વ-સહાય અને સ્વ-રોજગારી માટેની નક્કર અને સાકલ્યવાદી કામગીરીની ગાંધીવાદી પરંપરાને પ્રતિબિંબિત કરે છે. વર્ષોના અનુભવના આધારે અમે જાણ્યું છે કે સ્વ-નિર્ભરતા માટે ‘ચાર આધાર’ની જરૂર પડે છે:

1. મહિલાઓના નામે અસ્ક્યામતોનું નિર્માણ તથા મૂડીકરણ
2. સામાજિક સુરક્ષા જેમાં આરોગ્યની કાળજી શિશુ સંભાળ, વીમા કવચ, પેન્શન, પાણી અને સ્વચ્છતાની સુવિધા ધરાવતું રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે.
3. નેતૃત્વ માટે ક્ષમતા વર્ધન અને સભ્યપદ આધારિત સંગઠનોના વ્યવસ્થાપનનું નેતૃત્વ
4. નીતિ ધરવાના સ્તરે રજૂઆતને અવકાશ

આ તમામ આધારો તૈયાર કરવા જોઈએ અને તે સ્થાનિક સ્તરે સંચાલિત થવા જોઈએ. તેની સેવાઓ વિકેન્દ્રીકૃત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોવી જોઈએ. વાસ્તવમાં તમામ સેવાઓ અને કામગીરીઓ સહકારી મંડળીઓ અને સ્વ-સહાય જૂથો (એસએચ્યા) અને તેમનાં સંગઠનો મારફત જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવે છે.

અંતમાં, તમામ કામગીરી સ્થાનિક લોકો - અમારા કિસ્સામાં મહિલાઓના નિયંત્રણશમાં હોવાની સાથે-સાથે આ કામગીરીને લગતી નાણાંકીય બાબતોનું નિયંત્રણ અને યોગદાન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. ચંપારણમાં ગળીના ખેડૂતોના સંવર્ષ માટે બહારથી ભંડોળ ન લાવવામાં આવે તેની ગાંધીજીએ ખાસ કાળજી રાખી હતી. તે જ રીતે, તેમણે શરૂ કરેલી ઘણી ચણવળો અને સંઘર્ષોમાં લોકો સ્વયં જ ચણવળ શરૂ કરે, અને તે માટે તેઓ રોકડ અને સેવા સ્વરૂપે તેમનું યથાશક્તિ યોગદાન આપે તેવો તેમનો આગ્રહ હતો. આ બોધપાઠ સેવાના કાર્યકરોના માનસપટ પર અંકિત થઈ ચૂક્યો છે. ‘સેવા બેન્ક’, ‘સેવા ઇન્શ્યોરન્સ’ અથવા તો ‘વીમો સેવા’ સહિતનાં અમારાં તમામ સભ્યપદ આધારિત સંગઠનો નાણાંકીય રીતે સ્થિર છે અને બોર્ડ કે એક્ઝિક્યુટિવ કમિટીમાં ચૂંટાયેલી મહિલાઓ તેનું સંચાલન કરે છે. શિશુ સંભાળ સહકારી મંડળી અથવા તો ખેડૂત સહકારી મંડળી જેવાં સેવા ચણવળનાં અન્ય સંગઠનો સ્થિર થવા ભણી આગેક્ય કરી રહ્યાં છે. જો કે, તેમના માર્ગ આડે ઘણા પડકારો અને સંઘર્ષો રહેલા છે. વિકેન્દ્રીકૃત નિયંત્રણ, સ્વાયત્ત પરંતુ જવાબદેય કામગીરી અને સામૂહિક આગેવાની, ખાસ કરીને કામ કરતી મહિલાઓની આગેવાનીના સિદ્ધાન્તો આ તમામ સંગઠનોના કેન્દ્રસ્થાને રહેલા છે.

‘સેવા’નાં મૂલ્યો અને સિદ્ધાન્તો અમારી આજાદીની દાયકાઓ જૂની ચણવળ દરમિયાન સંગઠિતતા પર પ્રસ્થાપિત થયાં છે. જ્યાં ગળીના ખેડૂતોએ સૌપ્રથમ વાર અન્યાય અને શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તે બિધાર સહિત દેશભરની મહિલાઓને સંગઠિત કરીને ગાંધીજીનાં મૂલ્યોને જીવંત રાખવાનો અમારો પ્રયાસ છે. આ મૂલ્યો અને સિદ્ધાન્તો ગાંધીજીના સ્વરાજના વિચારને પણ આગળ ધ્યાવવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં સેવા ચણવળ બીજી આજાદી - ગરીબી અને ભૂખથી આજાદી મેળવવા અને સ્થાનિક મહિલાઓ અને પરિવારોને સ્વરાજ માટે સંગઠિત કરવા માટે કટિબદ્ધ છે. ચંપારણ સત્યાગ્રહની યાદો તાજી કરી રહ્યાં છીએ, ત્યારે અમે ગળીના ખેડૂતો અને તેમને અન્યાય અને ગરીબીના વિષયકમાંથી બહાર નીકળવા માટે નેતૃત્વ કરનારા ગાંધીજી તથા અન્યો પરથી પ્રેરણા લેવાની સાથે-સાથે આ સમગ્ર ઘટનાક્રમને સ્થાનિક લોકોને સાતત્યપૂર્ણ, પારદર્શી અને વિકેન્દ્રીકૃત રીતે સંગઠિત કરવાની પરંપરા અને ઇતિહાસ પર પ્રતિબિંબિત થતી તક તરીકે મૂલવીએ છીએ. ■

## વ્યથાના પ્રત્યક્ષ બયાનોની મહત્વતા:

### ચંપારણના ગળીના ખેડૂતોની સ્થિતિ અંગેના ગાંધીજીના અભ્યાસના અંશો

- બિનોય આર્યાઈ ('ઉન્નતિ'ના સ્થાપક તથા ડિરેક્ટર)

(ચંપારણ શતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય પરિસંવાદ 'ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ: પ્રયાસ, વારસો અને સમકાળીન ભારત',  
'ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી', શિમલા ખાતે પ્રસ્તુત, મે 29-31, 2017)

વથાના પ્રત્યક્ષ બયાનોનું એકત્રીકરણ કરવું, તેનો ઉપયોગ કરવો, તે સુપરત કરવાં, એફિડેવિટ કરવી, જુબાની આપવી અને ફરિયાદની નોંધણી કરાવવા જેવી કામગીરીઓનાં સમુદાયના સશક્તિકરણ, વર્ષોથી કે પેઢીઓથી તેમને જેનાથી વંચિત રાખવામાં આવ્યા હોય તેવા હક્કો તથા લાભો મેળવવા ક્ષેત્રે આ ચર્યજનક પરિણામો જોવાં મળ્યાં છે. શાનનું સર્જન કરવામાં વથાના પ્રત્યક્ષ બયાનોના પ્રભાવના સંદર્ભમાં વથાના પ્રત્યક્ષ બયાનો અંગે કાર્યપદ્ધતિના સ્તરે અભ્યાસો હાથ ધરાયા છે (સ્ટિવન એલ. રેનોલ્ડ્ઝ 'ટેસ્ટિમની, નોલેજ એન્ડ એપિસ્ટેમિક ગોલ્ઝ', ફિલોસોફિકલ સ્ટડીઝ, રોબટ ઓડી 'ટેસ્ટિમની એજ અ સોશયલ ફાઉન્ડેશન ઓફ નોલેજ'). જો કે, આનુભવિક સંશોધન મોટાભાગે 'સાક્ષીની વથાના પ્રત્યક્ષ બયાનો', 'સંગ્રહિત વથાના પ્રત્યક્ષ બયાનો' અથવા 'આત્મચરિત્રાત્મક વથાના પ્રત્યક્ષ બયાનો' પર હાથ ધરાયેલા છે. હક્કો અને મેળવાપાત્ર લાભો ન મેળવી શકનારા પીડિતોનાં પ્રમાણભૂત વથાના પ્રત્યક્ષ બયાનોના એકત્રીકરણની પદ્ધતિઓ તથા સમસ્યાને સમજાને આ અંગેની ફરિયાદનું નિવારણ કરવાની અપીલના સંદર્ભમાં તેની સુસંગતતાને લગતી પદ્ધતિઓ ખાસ ધ્યાન આકર્ષિતી નથી. ગરીબ, વંચિત અને શોષિત વર્ગની તરફેણમાં કાનૂની હક્કો મેળવવા માટે વથાના પ્રત્યક્ષ બયાનોનો ઉપયોગ થાય છે. દલિતોના હક્કોનું ઉત્ત્વલંઘન, માહિતીના પ્રચાર-પ્રસાર માટે મજદૂર કિસાન શક્તિ સંગઠનની કામગીરી, નિર્ભયા કેસ બાદ, જાતિ (વિંગ) આધારિત હિંસાનો અભ્યાસ કરવા માટે નિમાયેલી જસ્ટિસ વર્મા સમિતિ, ગુજરાતના તોફાનોના પીડિતોની વળતર માટેની માગણી અને 'જન વિકાસ - સેન્ટર ફોર સોશયલ જસ્ટિસ' દ્વારા કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી તથા ગુજરાતમાં એમજનરેગાની રાજ્ય સરીય સામાજિક ઓર્ડિટ વગેરેનો લેખકે જીડાવટપૂર્વક અભ્યાસ કર્યો છે.

અહીં ખાસ કરીને ચંપારણના ઐતિહાસિક સત્યાગ્રહમાંથી બોધપાઠ મેળવીને વથાના પ્રત્યક્ષ બયાનોનો પ્રભાવ અને અને વથાના પ્રત્યક્ષ બયાનો એકત્રિત કરવાની પદ્ધતિ સમજવાનો પ્રયત્ન થયો છે. તે સમેય ગાંધીજી 48 વર્ષની વયે નવા-સવા જ ભારત આવ્યા હતા. તેમણે પ્રત્યક્ષ સાક્ષી અને વથાના પ્રત્યક્ષ બયાનોનો ઉપયોગ કરીને

ચંપારણના ગળીના ખેડૂતોની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તેના કારણે ખેડૂતોના થતા શોષણ તથા તે અંગેની ખેડૂતોની ફરિયાદોની વિગતો બહાર આવી. (શાહિદ અમીન, 'લિસન ટુ ધ ચંપારન્ઝ પિપલ', ઇન્ડિયન એક્સપ્રેસ, એપ્રિલ 16, 2017) અહીં પ્રશ્ન એ થાય કે - દમન અને ભયના વાતાવરણની વચ્ચે પણ 4000 ખેડૂતો નિડરતાથી વધાન પ્રત્યક્ષ બયાનો આપવા માટે આગળ આવ્યા. સાબરમતી આશ્રમ ખાતે પ્રાચ્ય બયાનો અને આશરે 400 બયાનોની નકલો સૂચ્યવે છે કે માલિકીની જમીનના કંની દ્રષ્ટિએ તથા દલિત અને મુસ્લિમ સહિતના તમામ ખેડૂતોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા. એક બયાન એવું હતું કે જેમાં ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અન્ય ખેડૂતો વથાના પ્રત્યક્ષ બયાનો આપવા માટે આગળ નહીં આવે, ત્યાં સુધી તે બયાન આપી શકશે નહીં. ખેડૂતોની વિશાળ શ્રેણી પાસેથી વથાના પ્રત્યક્ષ બયાનો લેવાની અને તેનું એકત્રીકરણ કરવાની પદ્ધતિમાં કંઈક વિશેષ જરૂર હતું.

તાજેતરનાં વર્ષોમાં કાયદા માટેની માગ ઉભી કરવાના, કાયદો ઘડવાના અને પ્રત્યક્ષ બયાનોના એકત્રીકરણના ઘણા સફળ ઉપયોગો નોંધાયા છે. 'એમકેએસએસે' ઘણી જાહેર સુનાવણીઓ (જન સુનવાઈ) હાથ ધરી, મળવાપાત્ર લાભો કે હક્કોથી વંચિત રહેલા, તદન ઓછાં વેતન ભથ્થાં મેળવતા અથવા તો નબળી ગુણવત્તાની ગ્રામીણ માળખાકીય સુવિધા ધરાવતા ગરીબ લોકોની વથાના પ્રત્યક્ષ બયાનો લીધાં ત્યાર બાદ 'રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ)' રજૂ થયો. 'એમકેએસએસે' મોજૂદ ન હોય તેવાં જાહેર કાર્યો (રેકોર્ડ અનુસાર નાણાં ચુકવાઈ ગયાં હોય, પણ વાસ્તવિક કામગીરી હજ થઈ ન હોય તેવાં કાર્યો) માટેની બનાવટી ચુક્કણીઓ, સ્થાપિત હિતો ધરાવતી અયોગ્ય વ્યક્તિઓને હાઉસિંગ વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓની ફાળવણી વગેરે અંગેની જુબાનીઓ શ્રમિકો પાસેથી એકત્રિત કરી હતી. અને માધ્યમો, સરકારી અધિકારીઓ, નાગરિક સમાજના આગેવાનો અને જનતાનું આ વિગતો તરફ ધ્યાન દોર્યુ હતું. તેમણે લોક ગીતો, કઠપૂતળીના શો, શેરી નાટકો અને સુત્રોનાં વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કર્યો હતો. 'મૈને નહીં માંગા' (હું દુન્યાવી સુવિધાઓ નથી માંગતો, હું પૂરુષ વેતન, વેતનની રસીદ, શિક્ષકોની હાજરી અને

હોસ્પિટલમાં દવાઓ માંગું છું) - એ ગ્રાભ્ય સ્તરે માહિતીના પ્રસાર માટે 'અમકેઅસએસ'નું સૌથી લોકપ્રિય ગીત છે. પ્રત્યાયનની આ પદ્ધતિઓ માહિતી મેળવવાના અધિકાર અંગેની સામાન્ય વ્યક્તિઓની કલ્યના પ્રતિબિંબિત કરે છે. યુવાન સ્ત્રીઓ, વૃદ્ધો, વિધવા મહિલાઓ વ્યથાની પ્રત્યક્ષ બયાનો આપવા માટે મોટી સંખ્યામાં આગળ આવ્યાં હતાં. હાલમાં, અમકેઅસએસ સાથે આ પ્રક્રિયા શરૂ કરનાર શંકર સિંધ માહિતી જાહેર કરવા ક્ષેત્રે કાર્યરત કાર્યકર્તાઓના વર્તુળમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. આ પ્રક્રિયાના વિરોધરૂપે સ્વયંસેવકો અને બયાનો આપનાર વ્યક્તિઓને ધમકીઓ આપવામાં આવી અને તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો. આમ, ગામમાં પેન્શનની બાંધધરીયુક્ત ચૂકવણી, જાહેર વિતરણ વ્યવસ્થા - પીડીએસ રાશાન પ્રાથ્મ બનાવવું અને પ્રાથમિક આરાધ્ય કેન્દ્ર - પીએચ્સીમાં દવાઓ પ્રાથ્મ બનાવવાથી શરૂ થયેલી આ પ્રક્રિયા આખરે, 'રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ, 2005' અમલમાં લાવવા માટે નિર્ણાયક બની.

બીજું ઉદાહરણ જસ્ટિસ વર્મા સમિતિનું યાદ આવે છે. જે જાતિ (વિંગ) આધારિત હિંસાનો અત્યાસ કરવા માટે અને કાયદા માટેની ભલામણ કરવા માટે રચવામાં આવી હતી. સામાન્ય જનતા સાથે હાથ ધરવામાં આવેલી અસંખ્ય કાર્ય શિબિરો અને જાતીય હિંસાના પીડિતાની વ્યથાના પ્રત્યક્ષ બયાનો આ પ્રશ્ન અંગે સૂક્ષ્મ સમજ પૂરી પાડે છે. વધોવૃદ્ધ લોકો પણ તેઓ જ્યારે બાળકો હતાં, તે સમયે તેમણે વેઠેલી જાતીય હિંસા અંગે તેમનાં નિવેદનો આપ્યાં હતાં. સમવૈંગિક અને ટ્રાન્સજેન્ડર સમુદ્દરયના પ્રશ્નો સાંભળવામાં આવ્યાં હતાં અને તેમની વ્યથાના પ્રત્યક્ષ બયાનોનું કાળજીપૂર્વક દસ્તાવેજુકરણ કરવામાં આવ્યું હતું. સલાહ-મસલતને આધારે તેમના પ્રશ્નોના નિરાકરણ માટેની ભલામણો તૈયાર કરવામાં આવી હતી. યુવાન વકીલોની તાલીમબદ્ધ ટીમે સમર્પણ અને કાળજી સાથે દસ્તાવેજુકરણ હાથ ધર્યું હતું. જાતિ (વિંગ) આધારિત હિંસાને એક નવું પરિમાણ મળ્યું હતું અને આખરે ડિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપોસી)માં ફેરફાર કરીને તેમાં એસિડ હુમલા, પાઇણ પડવું અને બળાત્કારથી લઈને જાતીય હુમલા સહિતના ગુનાઓને આવરી લેવામાં આવ્યા. સામાન્ય લોકોને વિશ્વાસ હતો કે તે આ સમિતિ જાતિ (વિંગ) આધારિત હિંસા અંગેની ન્યાય પ્રક્રિયા અને જાતીય હિંસાના વિવિધ સ્વરૂપોની ઓળખ કરવામાં સીમાચિલ્નરૂપ ફેરફારો કરશે, અને આથી જે તેમણે આ પ્રક્રિયામાં ભાગ લીધો.

'અમણનરેગા'નું સામાજિક ઓડિટ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી હોવા છતાં, જે રીતે ગામડાંઓમાં આ પ્રક્રિયા હાથ ધરાય છે, તેના પગલે તે સામાન્ય વેતન મેળવતાં કામદારોને ગેરરીતિઓ સામે અવાજ ઊઠાવવા માટે સક્ષમ બનાવે છે. પીડિતોની વ્યથાના પ્રત્યક્ષ બયાનોને પગલે કેસ કાયદાકીય રીતે મજબૂત બને

છે અને સત્તાતંત્રની નજરમાં કેસની પ્રમાણભૂતતા વધુ મજબૂત બને છે. વાસ્તવિકતા સમજવામાં અને ફરિયાદ નિવારણ માટેની રજૂઆત કરવાની સાથે જ કાનૂની માળખાંની ઘોષણા કરવામાં બયાનોનીની સંભવિત તાકાતને અવગણી શકાય નહીં. ઉદાહરણરૂપે, એક દિવસ એક મહિલાએ ટેલિફોન હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવ્યું કે, અમણનરેગા માટેના એક મશીનનો ગામમાં ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો હતો. આ જાણીને ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવે જિલ્લા સત્તાધીશોને આ મામલે તપાસ હાથ ધરવા માટે જણાવ્યું. અધિકારીઓ ફરિયાદ કરનાર મહિલાના ઘરે ગયા અને તેમણે જે-તે સ્વયંની મુલાકાત લેવાના બદલે તે મહિલાને તમામ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. અધિકારીઓએ નોંધ્યું કે, મહિલા પાસે ખાસ કોઈ મહિતી ન હતી. ત્યારે સચિવે અધિકારીઓને પૂછ્યું કે તેમણે ફરિયાદ વિશે જાણકારી મેળવવાની હતી કે ફરિયાદીની તપાસ કરવાની હતી? આ સંદેશો યોગ્ય રીતે પહોંચ્યો હતો. આ સંદેશો સામાજિક ઓડિટ હાથ ધરવા માટે અને બયાનોનું એકત્રીકરણ કરવા માટેનો માર્ગદર્શક સિદ્ધાંત બન્યો.

ગુજરાતનાં તોફાનોના થોડા જ સમય બાદ સ્થાનિક માનવ અધિકાર સંગઠન, 'જન વિકાસ' અને 'સેન્ટર ફોર સોશિલ જસ્ટિસ'ને આગળથી જાણ થઈ ગઈ હતી કે અસરચ્યસ્ત અને આંતરિક રીતે વિસ્થાપિત લોકો (ઇન્ટરલી ડિસ્ક્લેર પીપલ (આઇડીપી)ને બાકી વળતર મેળવવામાં મુશ્કેલી થશે અને અમુક વ્યક્તિઓને તેમનો કેસ દાખલ કરવામાં પણ મુશ્કેલી પડશે. સંગઠન 'અનઅયારસી'નું પીઠળ ધરાવે છે, જે બયાનો એકત્રિત કરવાના કાર્યમાં કાયદેસરતા પૂરી પાડે છે. આ બયાનો સાક્ષી સાથે સ્ટેમ્પ પેપરમાં એફિડેવિટના સ્વરૂપમાં લેવામાં આવે છે. તેમણે વિવિધ જિલ્લાઓ પાસેથી 10,000 કરતાં વધુ વ્યથાના પ્રત્યક્ષ બયાનો એકત્રિત કર્યા હતા. તેમનો મુદ્રો હતો કે થયેલા નુકસાનનું માપન કરવા માટે જુબાનીઓની સંખ્યા અને ગુણવત્તા મહત્વનાં બની રહે છે. શરૂઆતમાં, સૈયદા હામિદ (ભૂતપૂર્વ મેઝ્બર, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા) અને હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો જેવી અગ્રણી વ્યક્તિઓએ જુબાનીઓ એકત્રિત કરી હતી. તેના કારણો આ પ્રક્રિયાની વિશ્વસનીયતા પ્રસ્થાપિત થઈ. પરિણામે, તાલીમબદ્ધ વકીલો અને કાયદા ક્ષેત્રના (પેરા લિગલ) વ્યાવસાયિકોએ ઝૂંબેશા સ્વરૂપે દસ્તાવેજુકરણ હાથ ધર્યું. પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરવા માટે વ્યથાના પ્રત્યક્ષ બયાનોનું એકત્રીકરણ કરવા દરમિયાન સ્વયંસેવકોએ તેમના ફોનના કેમેરામાં નુકસાનીની વિગતો મેળવી લીધી અને તે વિગતો રજૂ કરી. ઘણા લોકોએ ટપાલ દ્વારા પણ તેમના બયાનો મોકલ્યા. સ્કેજ અમથી ખોટી માહિતી ધરાવતા બયાનો પણ નોંધવામાં આવતા નહોતા. આ બાબત સ્થાનિક આગેવાનો મારફત સમુદ્દરયને સ્પષ્ટ જણાવી દેવામાં આવી હતી. જે પણ કેસ બળાત્કાર, જોખમી ઈજા અથવા હત્યા જેવા માનવ અધિકારોનો

ભંગ કરતા ગંભીર સ્વરૂપના હોય, તો તેવા કેસ જીણવટભર્યા તથ્યોની જાણકારી માગી લેતા હોવાથી તે ઉપરી અધિકારીઓને સુપરત કરવામાં આવતા હતા.

એવું જણાવવામાં આવ્યું હતું કે, વ્યથાના પ્રત્યક્ષ બયાનોની વ્યાપક સંખ્યાને કારણે ખોટ અને નુકસાનની માત્રાની જાણકારી મેળવી શકાઈ હતી અને તટસ્થ વળતર માટે સરકાર પર દબાણ ઊભું કરી શકાયું હતું. ઘણા ગંભીર કેસ માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ એફડેવિટ્સ ધ્યાન પર લીધી છે. ઠરાવના ટ્રાફિંગ કમિટિના એક સભ્ય અને એફડેવિટ્સના એકત્રીકરણ ક્ષેત્રે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ગગન સેઠી (જનવિકાસના સ્થાપક) ના જણાવ્યા પ્રમાણો, આ જુબાનીઓએ સામુદ્દર્યિક સંધર્ષનાં વિવિધ પરિમાણો આપ્યાં હતાં, જે કંયુનલ વાયોલન્સ બિલ ઘડવામાં મદદરૂપ બન્યાં હતાં. એ વાત અલગ છે કે આ બિલ પાલિમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર થયું નહોતું.

એક સૈકા અગાઉ, ગાંધીજી અને તેમના સ્વયંસેવકોની ટીમે ગળીના ખેડૂતોમાં આશા જન્માવવા માટે વ્યથાના પ્રત્યક્ષ બયાનોના ઉપયોગ દ્વારા આંદોલન છેણ્યું હતું. ખેડૂતો તેમની ભૌતિક, સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિઓ અડયણ વિના જણાવવા માટે સક્રમ બન્યા હતા. સાથે જે, તે સ્થાનિક સ્તરે પહેલ કરનાર પર ભાર મૂકે છે - ચંપારણના કિસસામાં આ પહેલ રાજકુમાર શુક્લાએ કરી હતી. અને રજકિશોર પ્રસાદ, રાજેન્ડ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાણી, મહાદેવ દેસાઈ, બી. ધરણીધર, બી. રામનવમી જેવી હસ્તીઓએ તેમના આ પગલાંનું સમર્થન કર્યું હતું તથા ભોજપુરી ભાષા બોલતા ખેડૂતોનાં નિવેદનોનો કાળજીપૂર્વક અનુવાદ કર્યો હતો તથા તેનું દસ્તાવેજુકરણ કર્યું હતું. આ પાછળનો મુખ્ય હેતુ સ્થાનિક પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાનો હતો. આ રીતે ગણોત્તિયાઓની પરિસ્થિતિનો સ્વતંત્રપણે તાગ મેળવવામાં આવ્યો હતો. આ તપાસનાં પરિણામ એટલું શક્તિશાળી હતું કે બિહાર અને ઓરિસસાના લે. ગવર્નર ઇ. એ. ગેટ તથા મુખ્ય સચિવ એચ. મેકફિસનને ગાંધીજી સાથે બેંક યોજવાની ફરજ પડી.

ડૉ. રાજેન્ડ્ર પ્રસાદે તેમના પુસ્તક 'સત્યાગ્રહ ઇન ચંપારણ'માં નિયા અને બેસ્સોરના ગળીના જેતરમાં કામ કરતા ગણોત્તિયાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે 1860માં કલકત્તામાં નીમવામાં આવેલા કમીશનનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોંધ્યું છે કે, સમૃદ્ધ ભદ્રલોક અને હરિષ ચંદ્ર મુખજી જેવી વ્યક્તિઓએ ગળીના ખેડૂતો અને ગણોત્તિયાઓ કમીશન સમક્ષ વ્યથાના પ્રત્યક્ષ બયાનો આપવા આવી શકે તે માટેની વ્યવસ્થા કરી. બંગાળનો બુદ્ધિજીવી વર્ગ પણ ખેડૂતોના સમર્થનમાં હતો. દીનબંધુ મિત્રા દ્વારા રચિત બંગાળી નાટક 'નીલ દર્પણ'માં

ગણોત્તિયાઓની સ્થિતિ તથા તેમના શોષણાની વાત દર્શાવાઈ હતી. સરકારે આ નાટક પર પ્રતિબંધ મૂક્યો, મિત્રાને કેદ કર્યા અને તેમને રૂ. 2000નો દંડ ફટકાર્યો. મીશનરીઓએ ટાંકયું હતું કે, 'ગળી ભરેલી એકેએક પેટી માનવ રક્તથી રંજિત થઈને હંલેન્ડ પહોંચે છે'. આ નિવેદનને પગલે સરકારી વર્તુળોમાં ઘણા વાપી ગઈ. એ નોંધવું પણ જરૂરી છે કે, ઘણા બ્રિટિશ અધિકારીઓ પણ ગણોત્તિયાઓ પ્રત્યે ફૂણું વલણ ધરાવતા હતા. જેમાં, મિ. વિલિયમ હર્શેલ - જેમને આગળ જતાં 'સર'ના જિતાબથી નવાજવામાં આવ્યા તથા મિ. એશ્લે એડન - જે આગળ જતાં બંગાળના લે. ગવર્નર નિયુક્ત થયા - તેમનો સમાવેશ થાય છે. આખરે, બંગાળના તત્કાલિન લે. ગવર્નર સર જણોન પિટર ગ્રાન્ટે પંચની લગભગ તમામ ભલામણો સ્વીકારી.

1860ના બંગાળ પંચના નિરૂપણ પરથી એ સ્પષ્ટ થાય છે કે ખેડૂતો અને ગણોત્તિયાઓની આ ચળવળને બોદ્ધિકો અને અધિકારીઓનું વ્યાપક સમર્થન સાંપડ્યું હતું. જો કે, 1917 સુધી પણ સ્થિતિ થાણે પડી નહોતી. રાજેન્દ્ર પ્રસાદે લખ્યું હતું કે, 'બિહારમાં ગણોત્તિયાઓની ફરિયાદો સાંભળવા માટે કોઈ હરિષ ચંદ્ર મુખરજી મોજૂદ નહોતા, કે કોઈ ગણોત્તિયાને પણ કલકત્તા પંચ વિશે કોઈ જાણકારી નહોતી'. જો કે, જમીનદારોએ ગણોત્તિયાઓ સાથે કોઈ સંધર્ષ ન હોવાનું રટણ ચાલુ રાય્યું. બિહાર લેજિસ્લેટિવ કાઉન્સિલ ખાતે 'ચંપારણ એગ્રિયન બિલ' અંગેના વક્તવ્યમાં મિ. મોહિં ગણોત્તિયાઓએ વેઠવી પડતી મુશ્કેલીઓનો સવિસ્તાર ચિતાર આવ્યો. જોકે, જમીનદારોએ તેમનું દબાણ ચાલુ રાય્યું. શરૂઆતના કેટલાક કેસોનો ચુકાદો ગણોત્તિયાઓની વિરુદ્ધમાં આવ્યો. 1912 સુધીમાં ગણોત્તિયાઓએ ગળીની ભેતી માટે જમીનનો ઉપયોગ કરવાની તીનકથિયા પદ્ધતિ અંગે સરકાર સમક્ષ પિટિશન કરવા માટેની માહિતી મેળવી. આ પદ્ધતિ બિનનફાકારક અને શોષણ કરનારી હતી. એક અંદાજ પ્રમાણો, પરંપરાના નામે આશરે 40 પ્રકારના ગેરકાયદેસર વેરા વસ્તુલવામાં આવતા હતા અને શોષણયુક્ત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 6 જુલાઈ, 1913ના રોજ સ્થાનિક અખભાર 'ધ બિહારી'માં સચોટ લેખ છાપવામાં આવ્યો. તેમ છતાં, જ્યારે લોડ હાર્ડિંગ પટના હાઇ કોર્ટનું ખાતમૂહૂર્ત કરવા આવ્યા ત્યારે તેમણે જમીનદારોને છાવરતાં જણાવ્યું કે ઉત્તર બિહારના જિલ્લાઓમાં જમીનદારો અને તેમની રૈયતનાં સંબંધો સુમેળભર્યા તેમજ સંતોષકારક છે.

ગાંધીજી ચંપારણ આવ્યા તે અગાઉ ત્યાં ગણોત્તિયાઓ માટે સ્થિતિ ઘણી જ પ્રતિકૂળ હતી. ત્યારે બાબુ બ્રિજકિશોર પ્રસાદે લેજિસ્લેટિવ કાઉન્સિલ સમક્ષ સુયોગ અધિકારીઓ અને બિન-અધિકારીઓની સમિતિ રચવાની અને સમજૂતી અધિકારીનો અહેવાલ જાહેર કરવાની માગણી કરી. સરકારે આ માગણી ફગાવી દીધી. ચંપારણની સ્થિતિથી

અજાણ હોય તેવા કેટલાક બિન-અધિકારી સભ્યોએ પ્રસાદને આ હરાવ પાછો જેંચી લેવા માટે જણાવ્યું. ગાંધીજીએ જણાવ્યું કે તેઓ જમીનદારોના સંગઠનના પ્રતિનિધિઓ તથા સરકાર સાથે મંત્રજાહ કરશે. ગાંધીજી એ પણ જાણતા હતા કે તેમને ચંપારણ છોડી દેવાનું વોરન્ટ પાઠવવામાં આવશે. એ સમજવું જરૂરી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં સર્જરી વ્યૂહરચના અને આયોજન સામેલ હતાં. 17મી એપ્રિલ, 1917 (અદાલતના ઐતિહાસિક દિવસ પહેલાં)ની આખી રાત કદાચ ગાંધીજીએ જાગીને વીતાવી હતી. રાજેન્દ્ર પ્રસાદે નોંધ્યું છે કે, ખેડૂતોની ફરિયાદો દૂર કરવાના અને સાથે જ તેમને દબાવી રહેવા જમીનદારોને હાનિ ન પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે ગાંધીજી જેલમાં જવા માટે તૈયાર હતા (પાના નં. 146-147). આ ઘટના કામગીરી પ્રત્યે ભરોસાપાત્રતા ઊભી કરવાનું ગાંધીજીનું કૌશલ્ય સૂચવે છે. વધુમાં રાજેન્દ્ર પ્રસાદે ઉમેર્યું હતું કે ચંપારણમાં ગાંધીજીના આગમન સાથે જ ખેડૂતોમાં સ્વાતંત્ર્ય અને નિરપણાની ભાવના સ્પષ્ટપણે જોઈ શકતી હતી. અલબત્ત, આ નિરરતા કામયલાઉ હતી કે પરિવર્તનનો પવન ફૂંકનારી હતી તે જણાવવું મુશ્કેલ છે. પ્રોફેસર મૃદુલા મુખરજીએ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ (એપ્રિલ, 17, 2017)ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગાંધીજી કરિશમાતી નેતા હતા તેથી જ તેઓ કરોડો લોકોને એકત્રિત કરી શકતા હતા. પણ સત્ય એ છે કે ભારતના અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો ખૂંદી વળવાની સઘન કામગીરી કરી હતી, જેના કારણો તેઓ છેવાડાના માનવીની સમસ્યાઓ સમજતા હતા. રોજબરોજના જીવનમાં તેઓ જેટલાં લોકોને મળતા હતા, તે સંચ્ચા પર નજર કરશો, એટલે હકીકત સમજાઈ...

ગાંધીજી અને તેમના અનુયાયીઓએ ગળીના ખેડૂતોની તથા અનુગામી ચળવળો સમયે લીધેલા વથાના પ્રત્યક્ષ બયાનોમાંથી કાર્ય પદ્ધતિ અંગેનો બોધપાઠ મેળવવા જરૂરી છે. સાંપ્રત પરિસ્થિતિમાં સામાજિક જીવનના સંશોધન અને હિમાયત માટે આ આધારભૂત યોગદાન બની રહેશે.

કાર્યપદ્ધતિને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણો છે:

1. જેમના નાગરિક હક્કોનો ભંગ થયો હોય તેવા, શોષણ અને અમાનવીય વ્યવહારનો ભોગ બનેલા લોકોની વથાના પ્રત્યક્ષ બયાનો લેવા એ તે લોકોની જટિલ વાસ્તવિકતાને સમજવા માટેની આદર્શ પદ્ધતિ હોવાની સાથે સાથે પીડિતોને સમજ કેળવવા માટે, વિશ્વેષણ કરવા માટે અને સંગઠિત થવા માટે વાચા આપતી અનિવાર્ય પ્રક્રિયા છે. તે કોઈ પણ પ્રકારના અર્થઘટન વિના અસરગ્રસ્તોના દ્રષ્ટિકોણથી વાસ્તવિકતા સમજવાની પ્રક્રિયા છે. તેને ‘પાઉલો ફેદરિઅન કોન્શનટાઇઝેશન’ તરીકે ઓળખાવી શકાય.

2. જો સંશોધનકર્તા અને સહભાગીઓ/સમુદ્દરયના અસરગ્રસ્તો વચ્ચે બયાનોના ઉપયોગ અંગે સ્પષ્ટતા પ્રવર્તતી હોય, તો પ્રશ્નના નિરાકરણમાં પ્રત્યક્ષ સામેલગીરીની પ્રેરણ મળી રહે છે. સાથે જ તેનાથી અસરગ્રસ્તોમાં એવી ભાવના જન્મે છે કે આ સમસ્યા ઘણા લોકો અનુભવી રહ્યા છે. સમસ્યા અંગેના તથ્યોની શોધથી લઈને તેના અંતિમ નિરાકરણ સુધીની સંપૂર્ણ સામેલગીરી હોવી જરૂરી છે.
3. વથાના પ્રત્યક્ષ બયાનો એકત્રિત કરવા એ ઘણી જ મહેનત માંગી લેતું ક્ષેત્રીય શ્રમકાર્ય છે. તે સમસ્યાના નિરાકરણ માટે સીધી સામેલગીરીને વેગ આપે છે. ગાંધીજીની એવી અપેક્ષા હતી કે બયાનોનું એકત્રીકરણ કરવાની સાથે-સાથે સ્વયંસેવકોએ ગામની સાફ-સફાઈ પણ કરવી જોઈએ, માર્ગાનું સમારકામ કરવું જોઈએ અથવા તો સ્વચ્છતાની સેવાઓમાં સુધારો લાવવો જોઈએ. ગાંધીજીએ જણાવ્યા પ્રમાણો - સ્વયં સેવકો પરિપક્વ, ભરોસાપાત્ર, મહેનતું પુરુષો હોવા જોઈએ અને તેમને હાથમાં પાવડો લેવામાં, ગામના માર્ગાનું સમારકામ કરવામાં, ગામને ચોખ્યું કરવામાં સંકોચ ન થવો જોઈએ. ઉપરાંત, જમીનદારો સાથે વાટાઘાટો કરીને રૈયતને યોગ્ય દિશામાં માર્ગદર્શન પૂરું પાડતા હોવા જોઈએ. એ (પાના નં. 256)ગાંધીજી હંમેશા કહેતા કે ‘જેને જ્ઞાતિના બાહ્યકારની પરવા ન હોય, જેણે સત્યની પડખે રહેવાનો નિર્ધાર કર્યો હોય અને ગરીબી અપનાવી હોય, ફક્ત તે વ્યક્તિ જ આવી સેવા કરવાની ક્ષમતા ધરાવે છે’ (પાના નં. 264).
4. ચંપારણ એગ્રેસિઅન એકટના સ્વરૂપમાં ટ્રૂક અને લાંબા ગાળે અનુકૂમે પરિસ્થિતિ બદલાશે અને વંચિતો સાથે અમાનવીય વ્યવહાર કરવાની પ્રવૃત્તિનો અંત આવશે તેવી આશા જન્મી હતી. ગાંધીજી કહેતા કે, ‘છેવાડાનાં લોકોની પરિસ્થિતિમાં સુધારો લાવીને જ આપણો સ્વરાજ મેળવી શકીશું.’
5. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અને માહિતીના આ વિપુલ જથ્થાને સ્વીકારનાર, તપાસનાર અને તેનું નિરાકરણ લાવનાર પંચ, સત્તા તંત્ર કે ક્યેરીની તટસ્થતા પર વિશ્વાસ રાખવો જરૂરી છે. ક્યેરીનું નૈતિક સત્તા તંત્ર સત્યની પડખે રહેશે તેવો ગાંધીજીને પૂરો વિશ્વાસ હતો.
6. સત્તા તંત્ર સાથે મુક્ત વાટાઘાટો યોજીને જીથ, ‘ગરીબ ખેડૂતોની ફરિયાદો દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે આ ખેડૂતોનું શોષણ કરનારા શોષણખોરોને હાનિ નહીં પહોંચાડવાનો’ જુસ્સો વ્યક્ત કરે છે. ગાંધીજી કદી પણ સત્તા તંત્ર પર બળજબરીપૂર્વકના દ્વારાણનો પ્રયોગ કરતા ન હતા. ઊલદું, સત્તા તંત્રને સમજવા માટે તેઓ સત્યાગ્રહ કરતા હતા. સત્તા તંત્ર સાથેની વાટાઘાટમાં તેઓ અત્યંત વિનન્દ્રા દર્શાવતા હતા.

7. લોકોને તેમની વાત, તેમની રજૂઆત અને ન્યાય મેળવવામાં તેમની એકતા - આ સમગ્ર પ્રક્રિયામાંથી શક્તિ મળવી હોઈએ.
8. સહભાગીઓ નિડરપણે ચણવળમાં ભાગ લેવા માટે પ્રેરાય તે માટે તેમનું ક્ષમતા વર્ધન કરવું એ ચંપારણ સત્યાગ્રહનો સૌથી મહત્વપૂર્ણ બોધપાઠ છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નોંધ્યું છે કે, ‘મહાત્મા ગાંધીના આગમનથી ચંપારણના ખેડૂતોમાં આજાઈ અને નિડરતાની ભાવના છલકાતી જોવા મળતી હતી’. 17મી એપ્રિલ, 1917ના રોજ ખેડૂતોએ સાવધાનીપૂર્વક વ્યથાના પ્રત્યક્ષ બયાનો આચ્છા, કારણ કે અધિકારીઓ તેમના પર નજર રાખી રહ્યા હતા અને તેમનાં બયાનો નોંધી રહ્યા હતા. જો કે, થોડા સમય પછી ખેડૂતો ભય રાચ્છા વિના રજૂઆત કરતા થયા. (પાના નં.143)
9. વ્યથાના પ્રત્યક્ષ બયાનો એકત્રિત કરવામાં માહિતગાર સંમતિ, છેતરપણીનો અભાવ અને ગુપ્તતાની જાળવણી અને મહત્વનાં પરિબળો બની રહે છે.
10. પીડિત વ્યક્તિની સહી ધરાવતા બયાનો ઉચ્ચ સ્તરની પ્રમાણભૂતતા ધરાવે છે. દસ્તાવેજુકરણ થયેલી આવી બયાનોની સંખ્યા અને ગુણવત્તા તે બયાનોને એફિડેવિટનો દરજાનો આપે છે.

બીજી ગોળમેજી પરિષદમાં ભારતમાં બંધારણીય સુધારાઓ અંગે ચર્ચા કરવા માટે જ્યારે ડૉ. આંબેડકરને દલિતોના કાયદેસર પ્રતિનિધિત્વ અંગે પૂછવામાં આવ્યો, ત્યારે પણ વ્યથાની પ્રત્યક્ષ બયાનોમાં રહેલી શક્તિ જોવા મળી હતી. પરિષદ દરમિયાન (સપ્ટેમ્બર-ડિસેમ્બર, 1931) ગાંધીજી માનતા હતા કે કોંગ્રેસ ભારતનાં તમામ સામાજિક જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે. ડૉ. આંબેડકરે દલિતો સાથે રાખવામાં આવતા ભેદભાવનો પ્રશ્ન ઊઠાવવા માટે દલિતોની અવદશ અને વિનંતીઓ અંગેની દલિતોની જ વ્યથાના પ્રત્યક્ષ બયાનો રજૂ કર્યા. જેને પગલે, બંધારણીય એકમો (મુસ્લિમો માટે કભૂનલ એવોડર્ઝની સાથે-સાથે) બંધારણમાં દલિતોના અલાયદા પ્રતિનિધિત્વની ડૉ. આંબેડકરની માગણી સ્વીકારવામાં આવી. જો કે, ગાંધીજીએ તેનો વિરોધ કર્યો અને તેમના અનિશ્ચિત કાળજીના ઉપવાસ દરમિયાન આંબેડકરે અનામત માટે સંમતિ દર્શાવી અને અલાયદા પ્રતિનિધિત્વની માગ પાછી બેંચી લીધી (પૂના સંધિ, 1932).

તાજેતરનાં વખોમાં આઈટી ઇનેબલ્ડ એપ્લિકેશન્સ થકી અભિપ્રાયોનું એકત્રીકરણ કરવા પર ભાર મૂકવામાં આવે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની

પસંદગી કરવામાં જાહેર સહભાગીતાને નોંધપાત્ર મહત્વ આપવામાં આવ્યું હતું. જેમાં, મોટા ભાગનાં શહેરોએ ભાગ લેવા માટે આઈટીથી સજ્જ વ્યવસ્થાનો ઉપયોગ કર્યો હોવાનું જોવા મળ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારે ફરિયાદની નોંધણી કરવા માટે આઈટી પોર્ટલ્સ તૈયાર કર્યા છે (પીજીપોર્ટલ એ ફરિયાદ નિવારણ માટેની વાપક સ્તરની વ્યવસ્થા છે). આ વ્યવસ્થાઓ ઉપયોગી હોવાની સાથે સાથે અસરકારક પણ છે. જો કે, બયાનોના એકત્રીકરણ થકી જે એકતા અને સભાનતાનું વાતાવરણ સર્જય છે, તે વાતાવરણ સર્જવામાં ઉપરોક્ત વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે. ઉપરાંત, પ્રોજેક્ટનું દીચ્છિત પરિણામ પ્રસ્થાપિત કરવા માટે અથવા તો સંશોધકનો દાવો સાચો છે તે સાબિત કરવા માટે બયાનોનો દુરૂપયોગ પણ થાય છે. પ્રોજેક્ટના મૂલ્યાંકન અંગેની એક રજૂઆતમાં, બેલાઇનની સાથે તુલના કરીને પ્રોજેક્ટનાં પરિણામોનું આલેખન દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને સમગ્રતાસાં સફળ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, જ્યારે ગામની મહિલાઓને આ પ્રોજેક્ટ અંગેના તેમના અનુભવો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટના અહેવાલમાં દર્શાવેલા આલેખન મુજબ તેમની સ્થિતિમાં આટલો સુધારો કેવી રીતે આવ્યો તે તેઓ સ્વયં નથી જાણતાં. વ્યથાના પ્રત્યક્ષ બયાનોનું મહત્વ અને તેની ક્ષમતા ઘટાડવા માટે અન્ય ઘણી પ્રક્રિયાઓ પણ જવાબદાર હોઈ શકે છે.

હક્કો અને મળવાપાત્ર લાભોનું રક્ષણ કરવા માટે અને રૂપાંતરણયુક્ત બંધારણીય પરિવર્તન લાવવા માટે વ્યથાના પ્રત્યક્ષ બયાનોના ઉપયોગ કરવાના અન્ય ઘણી માર્ગો હોઈ શકે છે. આવકનાં નિયંત્રણો વિના મત આપવાની બ્રિટનમાં થયેલી 19મી સદીની ‘ચાર્ટિસ્ટ્સ’ ચણવળ સહિતનાં દાખિસનાં ઘણાં સામાજિક આંદોલનોમાં વ્યથાના પ્રત્યક્ષ બયાનોનો કાયદાકીય પરિવર્તન કે સુધારણા લાવવા માટે ઉપયોગ થયો છે. ‘ચાર્ટિઝમ’ શબ્દ દસ લાખ કરતાં વધુ વ્યથાના પ્રત્યક્ષ બયાનો પર આધારિત ચાર્ટર પરથી પ્રયોજવામાં આવ્યો હતો. એ સમજ લેવું જરૂરી છે કે વ્યથાના પ્રત્યક્ષ બયાનોનું એકત્રીકરણ કરવું એ સંશોધન કાર્યપદ્ધતિ છે. હજારો પ્રત્યક્ષ બયાનોના આધારે જેના પાયા નંખાયા તે ચંપારણ સત્યાગ્રહ કદાચ આપણાને તેના શતાબ્દી વર્ષમાં વ્યથાના પ્રત્યક્ષ બયાનોના એકત્રીકરણની પદ્ધતિઓને સંશોધનના મહત્વના મુદ્દા તરીકે સામેલ કરવાની પ્રેરણ અને દિશાસૂચન પૂરાં પાડે છે.

# ‘ટ્રિપલ તલાક’ અંગેનો ચુકાદો મુસ્લિમ મહિલાઓની વાસ્તવિક દુર્દી દૂર કરવામાં નિષ્ફળ



ટ્રિપલ તલાક અંગે ‘ઇંડિરા જયસિંગ’ સાથેની મુલાકાતના અંશો બેતવા શર્મા, પોલિટિક્સ એડિટર દ્વારા તા. ૫.૮.૨૦૧૭ના રોજ HuffPost India વેબસાઈટ પર અંગેજ ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તેનું ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવ્યું છે. સ્ટ્રોટ: <http://www.huffingtonpost.in>. ઇંડિરા જયસિંગ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ છે અને તેઓ માનવ અધિકાર અંગે કામ કરે છે.

ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વતંત્ર ભારતના સૌથી મહત્વપૂર્ણ કાનૂની ચુકાદાઓ પૈકીનો એક છે. પાંચ મુસ્લિમ મહિલાઓએ ઇસ્લામમાં ફક્ત ત્રણ વખત તલાક બોલી દેવાથી, અને કેટલીક વખત તો એસએમએસ, હોટ્સએપ કે સ્કાઇપથી તલાક આપવાની પ્રથાને પડકારી હતી અને રૂઢિચુસ્ત મુસ્લિમ વિરુદ્ધ તેમની જીત થઈ હતી. આ ચુકાદો ઐતિહાસિક હોવાની સાથે-સાથે મુસ્લિમ પર્સનલ લો બોર્ડનીસત્તાને મર્યાદિત કરવા બદલ પણ સીમાચિન્હનરૂપ છે. કારણ કે, આજ સુધી દેશની અદાલતો કે કાયદો ઘડનારાઓએ પણ તેના ભેદભાવને પડકારવાનું સાહસ બેડયું ન હતું. તેથી, આ ચુકાદો અમુક અંશે નિરાશાજનક પણ છે.

ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ડેરવવામાં આવી હોવા છતાં, સુનાવણી હાથ ધરનાર પાંચ ન્યાયાધીશોએ રૂઢિચુસ્ત ધાર્મિક પરંપરા વિરુદ્ધ જઈને વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને જાતિગત સમાનતાને ઉતેજન આપવાનું ટાળ્યું હતું.

એક તરફ જસ્ટિસ રોહિન્ટન નરિમને એવો ફેસલો સંભળાયો હતો કે ટ્રિપલ તલાક ભારતીય બંધારણાની કલમ 14 હેઠળ સમાનતાના અધિકારનો ભંગ કરે છે. ન્યાયાધીશનું આ વલશ ઘણું જ મહત્વપૂર્ણ છે. તેનો અર્થ એ કે હવે આપણે મૂળભૂત હક્કો વિરુદ્ધના અન્ય અસમાનતા તરફ દોરનારા પર્સનલ લોને પડકારી શકીએ છીએ. તો બીજી તરફ, ટ્રિપલ તલાકને કારણે મહિલાઓએ સહન કરવા પડતા કષ્ટને લગતા આ કેસના ચુકાદામાં જાતિગત ન્યાયની ઝલક ભાગ્યે જ જોવા મળે છે. હા, જસ્ટિસ નરિમને ટ્રિપલ તલાકને -પ્રત્યક્ષ મન્સ્વીતા ગણાવી હતી. કારણ કે, મુસ્લિમ પુરુષો ‘તરંગી રીતે’ લગ્ન તોડી નાખી શકતા હતા.

જાતિગત સમાનતાના મામલે જસ્ટિસ એ. એસ. બેહર અને જસ્ટિસ અભુલ નાઝીર વચ્ચે વિચાર ભેદ સર્જયો હતો, જે અનુસાર, ટ્રિપલ

તલાક મૂળભૂત હક્કોનો ભંગ કરતા નથી અને બંધારણાની કલમ 25(1) મુસ્લિમ પર્સનલ લોનુંતથા ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ કરે છે. ફક્ત સંસદ ગૃહ જ આરોગ્ય, નૈતિકતા અને જાહેર વ્યવસ્થાના રક્ષણ માટે પર્સનલ લોમાં ફેરફાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ અંગે દલીલ કરનાર એકમાત્ર મહિલા વકીલ તથા ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ઇન્ડિરા જયસિંગે ચીફ જસ્ટિસ બેહરના મતને ‘દયનીય રીતે પછાત’ ગણાયું હતું.

‘હફ્પોસ્ટ ઇન્ડિયા’ સાથેની વાતચીત દરમિયાન જયસિંહે આ ચુકાદો જાતિગત અસમાનતાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યો હોવાની સાથે સાથે તેમાં ટ્રિપલ તલાકનો ભોગ બનનારી મહિલાઓએ વેઠવી પડતી વથી પર ભાગ્યે જ ધ્યાન અપાયું હોવાનું જણાયું હતું. સાથે જ, આ ચુકાદો મુસ્લિમ મહિલાઓ પર થતા દમનને વાસ્તવિક અર્થમાં હળવું કરે તેવી શક્યતા નહિવત્ત હોવાનું તેમણે ઉમેર્યું હતું. જયસિંગે ભવિષ્યમાં પણ પર્સનલ લોને પડકારવા અંગેના જસ્ટિસ નરિમનના ચુકાદાના પ્રભાવ વિશે ચર્ચા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, આ કેસ કેરળના શબ્દરીમાલા મંદિરમાં હિંદુ મહિલાઓને પ્રવેશની પરવાનગી અને કદાચ બાબરી મસ્જિદ-રામ મંદિર વિવાદ જેવી અન્ય ધાર્મિક બાબતો માટે પણ સૂચક બની રહેશે.

બેબાક સહકારી મંડળનું પ્રતિનિધિત્વ કરતાં જયસિંગે ભાજપ શાસિત સરકારે સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક વિરુદ્ધનું વલશ અપનાયું, ત્યારે એક વકીલ તરીકે તેમણે કેવી રીતે ટ્રિપલ તલાકના રાજનીતિકરણ પ્રત્યે કેવો અભિગમ અપનાયો તે વિશે પણ વાત કરી.

મારા મતે, ધર્મ એ મહિલાઓના હક્કોના મામલે છેલ્લી સીમા છે. ચુકાદામાં જાતિગત અન્યાયનો ઉલ્લેખ શા માટે ન થયો? આવું કેવી રીતે થયું?

આવું શી રીતે થયું. હું નિરાશ થઈ છું. હું એ બાબતે નિરાશ થઈ છું

કે સર્વોચ્ચ અદાલત એ સ્વીકારવામાં નિષ્ફળ રહી છે કે તે મહિલાઓનાં જીવન વિશે વાત કરી રહી હતી. આ જાતિને લગતો મુદ્દો હતો, પણ જાતિગત અન્યાયનો ક્યાંય ઉલ્લેખ જ ન થયો. ટ્રિપલ તલાક મહિલાઓના જીવનને કેટલું ભયાવહ રીતે પ્રભાવિત કરે છે તે અંગે એક શર્બત પણ ઉચ્ચારવામાં ન આવ્યો. હા, અપવાદુપે જસ્ટિસ નારિમને કહ્યું કે, આ ‘દેખીતી મનસ્વીતા’ છે. આવી મનસ્વીતા થકી કોઈ મહિલાનું જીવન કેવી રીતે બરબાદ થઈ જાય છે, આવી પ્રથા ભેદભાવયુક્ત છે, શા માટે કોઈ મુસ્લિમ પુરુષને જ ટ્રિપલ તલાક આપવાનો અધિકાર છે, તલાક મેળવનારી મહિલાઓના જીવનનું શું?

આ ચુકાદામાં માનવીય પાસાંનો અભાવ વર્તાય છે. એ યાદ રાખવું જોઈએ જાતિગત ન્યાય પણ માનવતા સંદર્ભે જ છે. બેશક તે કાયદા વિશે છે, પણ તમે કોના વિશે વાત કરી રહ્યા છો? તેના જીવન પર આની શું અસર પડશે અને તેને જાતિગત ન્યાય મળવો શા માટે જરૂરી છે?

હા, તમે જાણો છો કે તે પિટિશન શાયરા બાનોએ દાખલ કરી હતી. પણ, શાયરા બાનોએ જે યાતનાઓ વેઠી, તેને પગલે તે કોર્ટનું શરણ લેવા પ્રેરાઈ હતી. તે નારસુ અપ્પા માલી કેસને કારણો કોર્ટ પાસે નહોતી ગઈ (સ્ટેટ ઓફ બોઝે વિ. નારસુ અપ્પા માલી કેસમાં, બોઝે હાઈ કોર્ટ 1952માં પર્સનલ લો બંધારણીય પડકારથી મુક્ત હોવાનું ઠરાવ્યું હતું). આ તમામ વકીલોની દલીલો છે. વકીલોની દલીલો પ્રતિબિંબિત થાય છે, ધર્મશાસ્ત્રીઓની દલીલ પ્રતિબિંબિત થાય છે, પણ ટ્રિપલ તલાકનો ભોગ બનનારી મહિલાઓ ક્યાંય જોવા મળે છે?

આ ચુકાદામાં માનવીય પાસાંનો અભાવ વર્તાય છે. તો, આ ચુકાદાનો શું નિષ્કર્ષ નિકળે છે?

સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે છેલ્લાં 25 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. આ નિરાકરણ રાતોરાત નથી આવ્યું, કે પછી સરકારની ઈચ્છાક્રિયાને કારણો આ કામ પાર પડ્યું એવું પણ નથી. આ શક્ય બન્યું છે નવી પેઢીની મુસ્લિમ મહિલાઓને કારણો.

1984માં, શહેનાઝ શેખ નામ ધરાવતી મુસ્લિમ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં આ જ પ્રકારની પિટિશન દાખલ કરી હતી. આખરે, એક તબક્કે તેણે અદાલતના ચક્કર કાપવામાં સમય વેડફાને બદલે જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. તે પછીનો કેસ શાહ બાનોનો હતો. શાહ બાનો પણ વાસ્તવિક અર્થમાં એકલી હતી. અદાલતમાં સક્રિયતા જોવા મળે છે, પણ તે સક્રિયતા મુસ્લિમ મહિલાઓમાં જોવા મળતી નથી.

તો પ્રથમ વખત જ ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન, બેબાક સહકારી મંડળ અને વ્યક્તિગત મુસ્લિમો સ્પષ્ટપણે રજૂઆત કરતાં જોવા મળ્યાં છે. હવે, તેમની આશાઓ તથા ધ્યેયો પાર પડે છે કે કેમ તે જુદ્દે પ્રશ્ન છે. પરંતુ, હું એટલું જરૂર કહીશ કે તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ‘અમે આ કામ કરવા સક્ષમ છીએ’ તેવી લાગણી તેમનામાં જોવા મળી રહી છે. અને આ ભાવનાનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળશે.

છેલ્લાં 25 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત મુસ્લિમ મહિલાઓ હવે તેમની શક્તિઓનો ઉપયોગ કરવા માટે મુક્ત થઈ છે. આ ચુકાદો કેવી રીતે તેમની આશાઓ અને લક્ષ્યો સંતોષતો નથી?

કારણ કે આ હવામાં લટકતો ચુકાદો છે. આ ફક્ત એ પ્રકારની જાહેરાત છે કે ટ્રિપલ તલાક ગેરબંધારણીય છે. તેનો અર્થ એ નથી કે મુસ્લિમ પુરુષો ટ્રિપલ તલાક આપવાનું બંધ કરી દેશે. તમામ લોકો કાયદાને અનુરૂપ વર્તન કરશે તેવું નથી. આવા બનાવો બનશે અને ત્યારે આ મહિલાઓ અનુભવશે, ‘ચુકાદો તો આવ્યો, પણ તેનાથી શું ફરક પડ્યો?’ હજુ પણ મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો પણ હું શું કરી શકું છું? શું દર વખતે મારે અદાલત પહોંચ્યો જવું?’ આમ, નિરાશાની લાગણી જન્મશે.

હવે શું?

આ રસપ્રદ પ્રશ્ન છે. એટની જનરલે અદાલતમાં એવું નિવેદન કર્યું હતું કે, તમે તલાકને ગેરબંધારણીય જાહેર કરો, અમે કાયદો પસાર કરીશું. પણ મેં વાંચ્યું કે સરકારે એવું જણાવ્યું હતું કે કાયદો પસાર કરવાનો તેમનો કોઈ છરાદો નથી. આ ડરમણું ચિત્ર છે. મુસ્લિમ મહિલાને ફૂરતા અને ત્યજી દેવાનાં કારણોના આધારે ધૂટાછેડા લેવા માટે સક્ષમ બનાવતો ‘ધ વિમેન્સ રાઇટ ટુ ડિવોર્સ એક્ટ’, 1939 મોજૂદ જ છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે તે કાયદો મુસ્લિમ પુરુષોને પણ સમાન ધોરણે શા માટે લાગુ નથી પડતો? જ્યારે મુસ્લિમ મહિલાઓએ તેમના પતિ પાસેથી ધૂટાછેડા મેળવવા હોય, ત્યારે તેમણે આ કાયદા હેઠળ અદાલતનું શરણ લેવું પડે છે. પણ જો મુસ્લિમ પુરુષ ધૂટાછેડા લેવા ઈચ્છતો હોય, તો તે ધૂટાછેડાનાં અન્ય બે સ્વરૂપો પૈકીનું કોઈ પણ જુદ્દે શકે છે, જેને ગેરબંધારણીય જાહેર નથી કરાયું.

આ ચુકાદાએ તલાકનાં ત્રણ સ્વરૂપોમાંથી એક સ્વરૂપને જ ગેરબંધારણીય ઠરાવ્યું છે - જ્યારે એકસાથે ત્રણ વખત તલાક બોલીને ધૂટાછેડા આપવામાં આવે. પરંતુ, જો વ્યક્તિ એક સાથે ન બોલીને જુદા-જુદા સમયે બોલીને પણ તેની પત્નીને તલાક આપી શકે છે. તો મારો પ્રશ્ન એ છે કે, મુસ્લિમ પતિ ઈચ્છે ત્યારે તલાક બોલીને આપમેળે પત્નીથી ધૂટા થવાનો અધિકાર ધરાવે છે, તો પછી મહિલાએ ધૂટાછેડા

જોઈતા હોય, ત્યારે તેણે શા માટે અદાલતના શરણે જવું પડે છે? આ માટેનો કાયદો હોવો જરૂરી છે. મને એ જાણવાની ઈચ્છા છે કે સરકાર શા માટે કાયદાની જરૂર ન હોવાનું જણાવી રહી છે.

મુસ્લિમ પતિને શા માટે આપમેળે પત્નીથી છૂટાછેડા લેવાનો અધિકાર છે? પણ એવું થાય, તે પહેલાં શું એકસાથે ત્રણ વાર તલાક બોલીને (ટ્રિપલ) તલાક આપનાર પતિ માટેની સજાઓ નક્કી કરનારો કાયદો ન હોવો જોઈએ?

વિવિધ પ્રકારના કાયદા હોઈ શકે. પણ, મને નથી લાગતું કે મહિલાઓને સજા પૂરતી જણાય. આથી, મહિલાઓ ઈચ્છે તે પ્રમાણોનો કાયદો લાવવો જોઈએ. તેમને એવા કાયદાની જરૂર છે કે જેનાથી તેમને છૂટાછેડા અપાયેલી સ્ત્રીને આપવામાં આવતી ખોરાકી, બાળકનો કંજો, તેમની પોતાની ચીજવસ્તુઓ વગેરે સરળતાથી મળી શકે. પરંતુ, મુખ્ય મુદ્દો એ છે કે જો મુસ્લિમ પતિને છૂટાછેડા મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પાડવામાં આવે, તો તેની પત્નીને વધુ ન્યાયપૂર્ણ ચુકાદો મળી શકે છે.

જો હવે પુરુષ એકસામટા ત્રણ વાર બોલીને પત્નીને તલાક આપી દે, તો શું થશે? તેનું શું પરિણામ આવશે?

કશું જ નહીં થાય. તેનું પરિણામ એ આવશે કે મહિલા એમ કહી શકશે હું હજુ પણ પરિણાત જ છું. સાથે જ, તેણે હવે તે પરિણાત નથી તે પુરવાર કરવા માટે અદાલત સુધી નહીં જવું પડે. પણ આ મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પતિ એમ કહી શકે છે કે આ ટ્રિપલ તલાક નહોતા, પણ તલાક અહેસાન હતા: અર્થાત્, મેં ત્રણ મહિલાના ગાળા દરમિયાન તલાક આપ્યા હતા. જો આવું થાય, તો મહિલાની સ્થિતિ પાછી પૂર્વવત્ત થઈ જશે. અથવા તો તેણે તે ટ્રિપલ તલાક હતા, અને તલાક અહેસાન નહોતા તે સાબિત કરવા માટે અદાલતમાં જવું પડશે. અથવા તો કલમ 125 હેઠળ પોતે પરિણાત મહિલા હોવાનું જણાવીને વળતરની માગણી કરવાની રહેશે. આમ, તેણે અદાલતની કાર્યવાહીમાં સતત હાજર રહેવું પડશે. આથી, આ વિકલ્પ ખાસ ઉપયોગી નથી.

હવે, તમે કહેશો કે આવું તો હિંદુ મહિલા સાથે પણ થઈ શકે છે. હા, થઈ શકે છે. પણ, હિંદુ મહિલાના કિસ્સામાં પતિએ એવું પુરવાર કરવું પડે છે કે તેણે અદાલતમાં તેની પત્નીને છૂટાછેડા આપ્યા છે. આ એક મંચ બની રહે છે, જેમાં તમે તમારા હક્કો માટે રજૂઆત કરો છો. એવા ઘણા હિંદુ પુરુષો છે, જેમણે તેમની પત્નીનો ત્યાગ કર્યો હોય અને જતા રહ્યા હોય. પરંતુ, તેવા સંજોગોમાં પણ તેમની પત્ની પરિણાત સ્ત્રીનો દરજો ધરાવે છે અને તેથી તેઓ વૈવાહિક રહેણા અને જીવન નિર્વાહ માટેના જરૂરી વળતર પર સહેલાઈથી દાવો કરી શકે છે.

આ સામાન્ય સમસ્યા છે. તે ફક્ત મુસ્લિમ મહિલાઓ પૂરતી સીમિત નથી, પરંતુ મુસ્લિમ મહિલાઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલીભરી છે. પર્સનલ લોને પડકારવામાં જસ્ટિસ નરિમનનો ફેસલો કેટલા અંશે ઉપયોગી છે?

હકીકત નજર સામે જ છે. હું 101 જુદા-જુદા પર્સનલ લો જણાવી શકું છું, જે ભેદભાવયુક્ત છે અને જેને પડકારી શકાય છે. દાવો રજૂ કરવા માટે અથવા તો લિંગ આધારિત ભેદભાવનો દાવો સામેલ કરવા માટે આપણે જસ્ટિસ નરિમનના ચુકાદા પર આધાર રાખી શકીએ છીએ. તેમણે કુટુંબને લગતી બાબતોના કાયદાઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે અને સાથે જ મૂળભૂત હક્કોને અનુલક્ષીને તેની ચકાસણી કરવાનો અવકાશ પૂરો પાડ્યો છે. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે અદાલતમાં પર્સનલ લોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાની પરવાનગી આપવા પ્રત્યે આજે પણ ઉદાસીનતા પ્રવર્તે છે. હું માનું છું કે મહિલાઓના હક્કોનો પ્ર ન આવે, ત્યારે ધર્મ એ છેલ્લી સીમા છે. કામ કરવાનો અધિકાર, કાર્ય સ્થળે જાતીય પજવણી, કોલેજોમાં પ્રવેશ મેળવવામાં સમાનતા અને અનામત વગેરે જેવાં ક્ષેત્રોમાં મહિલાના હક્કોને મહત્વ અપાયું છે, પરંતુ, તેમને પરિવારના બંધારણીય કાયદામાં પ્રવેશની પરવાનગી નથી. જાણો કે, પુરુષનું ધર તેની માલિકીનો મહેલ હોય, જેમાં અન્ય કોઈ પ્રવેશી શકે નહીં. મહિલાઓની આ ચણવળ વિશ્વભરમાં ચાલી રહી છે. મારા મતે, કુટુંબના કાયદા એ એવા ટાપુ જેવા છે, કે જ્યાં બંધારણ સ્પર્શી શકતું નથી.

સુનાવણીના પ્રથમ ટિવસે તમે ન્યાયાધીશોને જણાવ્યું હતું કે નારસુ આપા માલીના કેસની ગુંચવણ દૂર કરવી જરૂરી છે. શું જસ્ટિસ નરિમનના ચુકાદા બાદ આ ગુંચ ઉકેલાઈ હોય. હું માનું છું કે અગાઉ આ ગુંચવણ આછી-પાતળી દ્રશ્યમાન હતી, પણ હવે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જસ્ટિસ નરિમનના આદેશ સ્વરૂપે સુપ્રીમ કોર્ટ પ્રથમ વાર જણાવ્યું છે કે પર્સનલ લોને પડકારી શકાય છે. શું આ મોટી વાત નથી? આ સાચે જ મોટી વાત છે. જસ્ટિસ નરિમને નવો અવકાશ સર્જો છે. હવે, તેનો મહત્તમ ઉપયોગ કરવાની જવાબદારી વકીલોની ભાવિ પેઢીની છે.

આ મામલે સુનાવણી હાથ ધરવા માટે વિવિધ ધર્મના જુદા જુદા પાંચ ન્યાયાધીશો રાખવા પાછળ કર્યું કારણ જવાબદાર છે?

લોકોના મતે, આ આંતરધર્મી અદાલત છે. પણ, એક ન્યાયાધીશ તરીકે, તમારે શ્રદ્ધાથી પર થઈને ફક્ત બંધારણને અનુલક્ષીને જે-તે બાબત ચકાસવાની હોય છે. આ ચુકાદા દ્વારા આસ્થાનો મર્મ રજૂ

કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધર્મ એટલે શું અને ઈસ્લામનો ઉપદેશ શું છે તે જણાવવામાં આવ્યું છે. પાંચ પૈકીના એક પણ ન્યાયાધીશ ઈસ્લામના નિષ્ઠાત નથી, મૌલવી નથી, ઈસ્લામિક જ્યુરિસ્ટ નથી અને તેમ છતાં, તેઓ આપણાને ઈસ્લામનો અર્થ સમજાવે છે. આ સ્વીકારવું મુશ્કેલ છે.

તો, તમારા મતે, ઉત્સાહમાં આવી જવાની જરૂર નથી. હા. ધર્મને લગતી ન હોય તેવી બાબત જાણવી જરૂરી છે, અને તે પછી નિર્ણય લેવો જોઈએ. આખરે તો, ઈન્ડિયન પીનલ કોડ તમામ ભારતીય નાગરિકોને લાગુ પડે છે. આથી, તમે એવું ન કહી શકો કે મુસ્લિમ પર્સનલ લોમાં હસ્તક્ષેપ ન થઈ શકે.

ઇન્ડિયન પીનલ કોડ તમામ ભારતીય નાગરિકોને લાગુ પડે છે. આથી, તમે એવું ન કહી શકો કે મુસ્લિમ પર્સનલ લોમાં હસ્તક્ષેપ ન કરી શકાય. ટ્રિપલ તલાકનો કેસ રાજકીય રંગ પણ ધરાવતો હતો. તેવા સંજોગોમાં, એક વડીલ તરીકે તમે તેને કેવી રીતે મૂલ્યાં છો? આ વ્યાપક રાજકારણ ધરાવતો કેસ હતો. પહેલો નિર્ણય એ લેવાનો હતો કે અદાલતમાં પ્રવેશવું કે ન પ્રવેશવું. આપણે સૌ જાણીએ છીએ કે આ મુદ્દો સરકાર દ્વારા ઊદાવાયો હતો. સાથે જ, આપણે એ પણ જાણીએ છીએ કે વાસ્તવમાં જોઈએ તો, સરકારને લઘુમતીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી.

આ હકીકત એ તથ્યો પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર પ્રદેશમાં લઘુમતીઓનું કોઈ પ્રતિનિધિત્વ નથી, સાથે જ ત્યાં થતી મનસ્વી હિંસાખોરી તથા અન્ય ઘણાં પરિબળો આ હકીકત છતી કરે છે. આથી, એક અભિગમ અનુસાર, અદાલતનો બહિઝ્કાર કરવો અને તેને રાજકીય મુદ્દો ગણાવીને જે થાય તે થવા દેવું. પણ તે પછી, ગહન મંથન કરતાં એ સ્પષ્ટ થાય છે કે અદાલત એ લોકશાહી ક્ષેત્ર છે. આથી, પ્રશ્ન એ થાય કે બિનસાંપ્રદાયિક વ્યક્તિ તરીકે, શું આપણે આ ક્ષેત્ર છોડી દેવું જોઈએ કે પછી અદાલતમાં હાજર થઈને આપણા વિચારો રજૂ કરવા જોઈએ? આ સિવાય, અમે એ દર્શાવવા ઈચ્છતા હતા કે મુસ્લિમ મહિલાઓ નિર્ણયિક ભૂમિકા ધરાવે છે. તેમણે આ ચણવળ આદરી છે અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ ક્ષેત્રમાં પ્રવેશવા પાછળનું ત્રીજું કારણ એ હતું કે જે પણ ચુકાદો આવે, તે શબ્દરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની દ્રુટ મળે વગેરે જેવા પ્રશ્નોને પણ પ્રભાવિત કરશે. આથી, આ કેસ ફક્ત મુસ્લિમ મહિલાઓ પૂરતો સીમિત ન રહેતાં, તમામ મહિલાઓ માટે મહત્વનો બની રહ્યો. હિંદુ મહિલાઓએ પણ બેદભાવનો ભોગ બનવું પડે છે. આખરે તેના કારણો મને આ કેસ પાછળ આટલો સમય ફાળવવાની ફરજ પડી.

આ સિવાય, અમે એ દર્શાવવા ઈચ્છતા હતા કે મુસ્લિમ મહિલાઓ નિર્ણયિક ભૂમિકા ધરાવે છે. તેમણે આ ચણવળ આદરી છે અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ ચુકાદા થકી પર્સનલ લોને પડકારવાનો માર્ગ મોકળો થયો હોવાથી તમે આ ચુકાદાને 'મહત્વપૂર્ણ' ગણાવો છો. પણ સાથે સાથે તમે નિરાશ પણ જણાઓ છો.

મિત્રો અને સહકર્મીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દો હાથ પર લેતાં મને એક વર્ષ લાગ્યું હતું. અને તેથી જ, આ ચુકાદો આવા ગંભીર મુદ્દા અંગે ચિંતન કરવા માટેના સમયનો અભાવ ધરાવે છે તે નિરાશાજનક છે. એક ચીફ જસ્ટિસ છે, જેઓ નિવૃત્ત થવાના છે અને તેઓ મે મહિનામાં સુનાવણી નક્કી કરે છે. મેં તમને જણાવ્યું તેમ મને પૂર્વતૈયારી કરતાં એક વર્ષ થયું હતું અને મને ખાતરી છે કે આ સમગ્ર મામલા અંગે વિચારણ કરીને તેના માટેની દલીલો તૈયાર કરવા પાછળ અન્ય વ્યક્તિઓને ઘણો સમય લાગ્યો હશે. આથી, મેમાં સુનાવણી રાખવી અને ઓગસ્ટ સુધીમાં ચુકાદો આપી દેવો એ મારા મત સેણ ઉતાવણીયું પગલું છે. તેના પ્રતિભાવો તમે જોઈ શકો છો. ચીફ જસ્ટિસનો અંશી ટકા ચુકાદો કર્ય વ્યક્તિ શું કહે છે તેના પર આધારિત છે. આમ થયું હતું, તેમ થયું હતું, વગેરે વગેરે. એક વાક્યનો બીજા વાક્ય સાથે યોગ્ય મેળ નથી બેસતો. એક ફકરો બીજા ફકરા સાથે યોગ્ય રીતે નથી જોડતો. આથી, એવી છાપ ઉપસે છે કે આ કામ કોઈ પણ ભોગે 25મી ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરી દેવાનું છે.

જસ્ટિસ કુરિયનાનો ચુકાદો પણ કંઈક આ જ પ્રકારનો છે. તેમનો ચુકાદો ઘણો જ ટૂંકો છે. બેશક, તેમણે જણાવ્યું હતું કે આસ્થાની દ્રષ્ટિએ ખરાબ ગણાવાઈ હોય, તે બાબત કાયદાની દ્રષ્ટિએ ખરાબ જ હોય છે. પણ, તેમણે આવું શા માટે હોય છે - તે નથી સમજાવ્યું. શું કાયદાની દ્રષ્ટિએ ખરાબ હોય, તેવી કોઈ બાબત આસ્થાની દ્રષ્ટિએ પણ ખરાબ જ હોય છે? જવાબ નકારમાં હોઈ શકે છે. કાયદાની દ્રષ્ટિએ ખરાબ હોય તેવી બાબત આસ્થાની દ્રષ્ટિએ સારી પણ હોઈ શકે છે. આથી, આ દલીલનું નિરાકરણ આવે તે જરૂરી છે.

આ ચુકાદો આવા ગંભીર મુદ્દા અંગે ચિંતન કરવા માટે સમયનો અભાવ ધરાવે છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે. સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા. તો, સમગ્ર પરિસ્થિતિના પરિપ્રેક્ષયમાં, શું આ બાબત નિરાશાજનક છે કે પ્રોત્સાહક? કદમ ભલે નાનું હોય, પણ મને એ વાતની ખુશી છે કે આપણે યોગ્ય દિશા તરફ ડગલું ભર્યું. મારા મતે, આ લડતને આગળ ધપાવવાની જવાબદારી નારીવાદી વકીલોની ભાવિ પેઢીની છે. ■

# સમુદ્દર્યો કેવી રીતે સ્પર્શિંગ વિના ગટર વ્યવસ્થાનું વ્યવસ્થાપન કરી શકે?

J-PAL સાથે સંકળાયેલા અભ્યાસુઓએ ખુલ્લામાં હાજરે જવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના મહત્વના મુદ્દાઓ વિશે સમજ મેળવવા તેનું મૂલ્યાંકન કર્યું હતું, તે અંગેનો લેખ [www.icontact-archive.com](http://www.icontact-archive.com) પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેનું ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવ્યું છે.

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ખુલ્લામાં હાજરે જવાની કિયા 2019 સુધીમાં સમગ્ર દેશભરમાં બંધ થઈ જશે તેવો અંદાજ છે. ગ્રામીણ વિસ્તારોમાં 4.7 કરોડ નવાં શૌચાલયોના નિર્માણ બાદ, અભિગમમાં પરિવર્તન અને પરિણામોની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે આ લક્ષ્ય પાર પાડવા માટે લોક-સમૂહની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તે મુદ્દે સંઘન અભ્યાસો હાથ ધરાઈ રહ્યા છે.

J-PAL સાથે સંકળાયેલા અભ્યાસુઓએ ખુલ્લામાં હાજરે જવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના મહત્વના મુદ્દાઓ વિશે સમજ મેળવવા તેનું મૂલ્યાંકન કર્યું છે. આ તારણો પરથી એ પ્રશ્ન થાય છે કે શું ખુલ્લામાં હાજરે જનારાં લોકો વર્તમાન શૌચાલય તકનીક સાથે અનુકૂલન સાધી શકશે? કે પછી સ્વચ્છતાના ઉપયોગે ભારતીય પરિગ્રેઝ્યમાં અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વધુ નવતર પહેલ અને મૂલ્યાંકનની જરૂર છે? લાખોની સંખ્યામાં શૌચાલયોનું નિર્માણ કરવા છતાં, શૌચાલય-વિહોણાં લોકો તેમનો ઉપયોગ નથી કરતાં. ‘ધ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4’ દ્વારા 6,00,000 પરિવારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે અનુસાર, 51.6 ટકા શહેરી અને ગ્રામીણ પરિવારો શૌચાલયની સુવિધાનો ઉપયોગ ન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ‘કોઝી એન્ડ સ્પિર્સ’ના તાજેતરના પુસ્તક ‘હેલ ઇન્ડિયા ગોડ’માં એવી દલીલ કરવામાં આવી છે કે,



સર્વે કરનાર હાજરે જવાની કિયા અંગે જુવનેશ્રમાં પ્રશ્નો પૂછી રહ્યા છે (ફોટો: ગૌતમ પટેલ, સિનિયર પોલિસી મેનેજર, J-PAL દક્ષિણ એશિયા)

ગ્રામીણ પ્રદેશોમાં શૌચાલયોનો વપરાશ ન થતો હોવાનું સૌથી મોહું કારણ એ છે કે લોકોને એ ચિંતા સત્તાવતી હોય છે કે ખાડો ભરાઈ જશે, ત્યારે નિકાલની વ્યવસ્થા કોણ સંભાળશે? ટ્રિવન-પિટ સોલ્યુશનના ડિમાયતી જણાવે છે કે ખાડો ભરાઈ જાય અને તેને એક વર્ષ સુધી રાખી મૂકવામાં આવે, તે પછી વપરાશકર્તાઓ સ્કૂલ મળનો સરળતાથી નિકાલ કરી શકે છે અને ખાતર તરીકે તેને ઉપયોગમાં લઈ શકે છે. જો કે, આ વર્ષના પ્રારંભમાં કેટલાક સિનિયર આઇએએસ અધિકારીઓએ કહ્યું હતું તે પ્રમાણે, જો કોઈ ખાડામાં પ્રવેશવા તૈયાર ન હોય, તો અન્ય કોઈને નાણાં ચૂકવીને તેની પાસે આ કામગીરી કરવી શકાય છે. વળી, એક ડ્રાષ્ટિકોણ એવો પણ છે કે ટ્રિવન-પિટ શૌચાલયો જરૂરી ભરાઈ જાય છે, જેથી સમૃદ્ધ વ્યક્તિઓ વિશાળ મળ-ટાંકીઓ પાછળ નાણાં ખર્ચે છે, પરંતુ, ગરીબ વ્યક્તિઓને આ વિકલ્ય પરવડતો નથી.

## ગરીબ વર્ગને ઉતેજન આપવું કે પ્રેરણા આપવી પૂરતાં નથી, શૌચાલયો પોખાય તેવા હોવાં જોઈએ

ભારતના વસ્તી ગીયતા ધરાવતા પાડેશી દેશ બાંગલાદેશમાં અચોક્કસ મૂલ્યાંકનના આધારે જાણવા મળ્યું હતું કે જે વિસ્તારમાં એક સ્વૈચ્છિક સંસ્થા શૌચાલયો માટે ઉતેજન અને સબસિડી પૂરાં પાડતી હતી, તે વિસ્તારના પરિવારોમાં શૌચાલયો બંધાવવા પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાન સમુદ્દરાયને ઉતેજન આપવાના આ સમાન મોડેલ - કમ્પ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશન (સીએલટીએસ)નો ઉપયોગ કરી રહ્યું છે. કમ્પ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશન ખુલ્લામાં હાજરે જવાની કિયાનાં નકારાત્મક પાસાં તરફ લોકોનું ધ્યાન દોરે છે, આરોગ્ય પર પડતી વિપરિત અસરો જણાવે છે અને સ્વચ્છતાને વેગ આપે છે. આ અભ્યાસના આધારે જાણવા મળ્યું હતું કે, સમુદ્દરાયને તેમના ખર્ચે શૌચાલયો બંધાવવા માટે ઉતેજન આપવામાં આવે, તો તેનાથી શૌચાલયોનો ઉપયોગ કરવાના કે ખુલ્લામાં હાજરે જવાના પ્રમાણમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નહોતો. જ્યારે કમ્પ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશનની સાથે સબસિડીની પણ સુવિધા

(શૌચાલયના કુલ ખર્ચમાં 75 ટકા સબસિડી) આપવામાં આવી, ત્યારે નોંધપાત્ર પ્રભાવ જોવા મળ્યો. આ સૂચવે છે કે શૌચાલયો ગરીબને પોસાય તેવાં જોઈએ, કારણ કે, વ્યાપક સ્તરે હાથ ધરાયેલાં સંશોધનોના આધારે નાણાંકીય સુવિધા પ્રતિરોધક આરોગ્ય ઉત્પાદનોનો ઉપયોગ કરવા આડે અવરોધરૂપ બનતી હોવાનું માલૂમ પડ્યું હતું. અભ્યાસના આધારે એ પણ જાણવા મળ્યું હતું કે, આડોશ-પાડોશમાં નાણાંકીય સહાયનું ઓછું વિતરણ કરવામાં આવ્યું હોય તેની સરખામણીએ વધુ વિતરણ કરવામાં આવ્યું હોય, ત્યાં વધુને વધુ પરિવારોએ આ નાણાંકીય સહાયનો ઉપયોગ કર્યો હતો. નિકટતમ સમુદ્દરમાં નાણાંકીય સહાયની યોગ્ય માત્રા વ્યક્તિના અભિગમમાં પરિવર્તન લાવવા માટે અસરકારક સાધન બની રહે છે.

જ્યારે, ગ્રામીણ ઇન્ડોનેશિયામાં અચોક્કસ મૂલ્યાંકનના આધારે જાણવા મળ્યું હતું કે, અત્યંત ગરીબ પરિવારોને શૌચાલયો ન પરવડતાં હોવાથી કભ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશનનો તેમના પર ખાસ કોઈ પ્રભાવ પડ્યો નહોતો. જ્યારે, ગરીબ ન હોય તેવા પરિવારોએ શૌચાલયો બંધાવ્યાં હતાં, જેથી જંતુઓનો ઉપદ્રવ ઘટયો હતો, અને ખુલ્લામાં હાજરે જવાની કિયાનો તેમણે વ્યાપક બહિઝ્કાર કર્યો હતો. 160 ગામોમાં કભ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશનના વ્યાપક અમલીકરણ માટે બે પ્રકારની પદ્ધતિઓના પ્રભાવનો અભ્યાસ કર્યો હતો. જ્યાં તાલીમબદ્ધ વ્યાવસાયિક સંસાધન એજન્સીઓએ કભ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશનનો અમલ કર્યો હતો, ત્યાં શૌચાલયોના નિર્માણની કામગીરી સંતોષકારક જણાઈ હતી, પરંતુ જ્યાં સ્થાનિક સરકારો દ્વારા શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યાં નિરાશાજનક સ્થિતિ પ્રવર્તતી હતી. આમ, અમલીકરણની પદ્ધતિ એકદમ સ્પષ્ટ હોવા છતાં, સરકારી તંત્ર દ્વારા નિર્માણ કાર્ય આગળ ધપાવવામાં આવે, તે સામે કયા કયા પડકારો રહેલા છે, તે આ મૂલ્યાંકન દ્વારા જાણી શકાય છે.

## શહેરી સમુદાયો કેવી રીતે તેમનાં શૌચાલયોનું વ્યવસ્થાપન કરે છે?

તાજેતરમાં દિલહીના સફાઈકર્મીઓ ગટરોની સફાઈ દરમિયાન મોતને ભેટચા હતા, તેની સાથે જ દેશભરમાં આ રીતે અંદાજે 1300 સફાઈકર્મીઓનાં મોત નીપજતાં હોવાના આંચયકાજનક સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. ગ્રામીણ ભારતમાં, આશરે 1,68,066 પરિવારોએ સામાજિક-આર્થિક જ્ઞાતિ (આધારિત) વસ્તી ગણતરી, 2011માં સ્વયંને સફાઈકર્મી તરીકે ઓળખાવ્યા હતા. સફાઈકર્મીઓને મળ-મૂત્ર સ્પર્શવા પર પ્રતિબંધ ફરમાવતા તાજેતરના કાયદા અને ગટર કયરાનો નિકાલ કરતાં મશીનો અને ઉપકરણોની પ્રાપ્તિ છતાં આ સ્થિતિ પ્રવર્તે છે. તેમાંથી, શહેરોમાં અપૂર્ણ વ્યવસ્થાઓને કારણે ગટરના નિકાલની સ્થિતિ વધુ બદલી રહે છે. 2015ના

અનઅેસઅેસાઓના સર્વે અનુસાર, 60 ટકા કરતાંથી વધુ વોર્ડ સમુદાય અને જાહેર શૌચાલયો માટે પ્રવાહી કયરાની યોગ્ય નિકાલ વ્યવસ્થા નથી ધરાવતા. ‘સ્વચ્છ ભારત અર્બન ડેશબોર્ડ’ મુજબ 1.8 લાખ નવાં સામુદાયિક અને જાહેર શૌચાલયો બાંધવામાં આવ્યા હતાં, સરકારે શહેરી ઘન કયરા વ્યવસ્થાપન માટે 2015માં 25 ટકા ભંડોળ ફળવ્યું હતું, તે ટકાવારી 2016માં વધારીને 51 ટકા કરી હતી.

ઓરિસ્સામાં કાર્યરત અચોક્કસ મૂલ્યાંકન હેઠળ, શહેરી સમુદાયો સ્વચ્છતાને લગતી સુવિધાઓનું કેવી રીતે વ્યવસ્થાપન કરે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રારંભિક સર્વે દરમિયાન માલૂમ પડ્યું હતું કે ભુવનેશ્વર અને કટ્ટટકના ઝૂપડપટ્ટી વિસ્તારોમાં આશરે 45 ટકા પરિવારો જાહેર કે સામુદાયિક શૌચાલયોનો ઉપયોગ કરતા હતા. જો કે, અંધા કરતાંથી વધુ શૌચાલયો ગંદા અથવા તો અંયંત ગંદા હતા. આશરે ત્રીજા ભાગના પરિવારો ખુલ્લામાં હાજરે જતા હતા. મૂલ્યાંકન કરવા માટે, મ્યાનિસિપલ કોર્પોરેશને હવા-ઉિઝસ અને પ્રકાશની સગવડ સાથેનાં નવાં શૌચાલયો બંધાવ્યાં. સાથે જ કપડાં ધોવાની અને નહાવાની વધારાની સુવિધા પણ ઊભી કરી. દરેક શૌચાલય માટે સામુદાયિક વ્યવસ્થાપન સમિતિ (કભ્યુનિટી મેનેજમેન્ટ કમિટી) નિયુક્ત કરવામાં આવી, જે શૌચાલયની સુવિધા યોગ્ય રીતે ચાલુ રહે તેની જવાબદારી ધરાવતી હતી. શૌચાલયની સંભાળ માટે એક વક્તિ અને સફાઈકર્મી પણ રાખવામાં આવ્યો. આ સુવિધાઓનો ઉપયોગ કરનાર વપરાશકર્તા પાસેથી ફી વસૂલવામાં આવે છે અને આ રકમ સમિતિના બેન્કના ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ થકી શૌચાલયના વ્યવસ્થાપનનો ખર્ચ ઊદાવવામાં આવે છે. આ અભ્યાસમાં લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે કભ્યુનિટી-લેડ ટોટલ સેનિટેશન અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ, સમુદાયો સફણતાપૂર્વક સ્વચ્છ શૌચાલયોનું વ્યવસ્થાપન કરે તે માટેનું સાતાયપૂર્ણ મોડલ નક્કી કરવા માટે વિવિધ સબસિડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અચોક્કસ મૂલ્યાંકનોનો આ સમૂહ સામુદાયિક ઉત્તેજનની દરમિયાનગીરીઓ (કામગીરીઓ)નું મહત્વ સૂચવે છે. સાથે જ તે સૂચવે છે કે શૌચાલયો ગ્રાસ બને અને આરોગ્યનાં હકારાત્મક પરિણામો મળી રહે તે માટે સ્વચ્છતાની સુવિધાઓ ગરીબોને પોસાઈ રહે તે જરૂરી છે. ભારતીય પરિપ્રેક્ષયમાં સ્વચ્છતાની સુવિધાઓના અભ્યાસો થકી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છ અને સુવિધાયુક્ત શૌચાલયો આડે અંચણરૂપ બનતાં ખર્ચ અને માનસિકતાને હકારાત્મકતામાં પરિવર્તિત કરીને આવા પરિવારો સુધી અસરકારક રીતે પહોંચ વિસ્તારવી શક્ય છે. ■

# જળ યોધા:

## બુંદેલખંડમાં જળ સહેલીઓ બની નારી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

‘વેલ્થહંગરહિલ્ફ’ એ ‘યુરોપીય યુનિયન - ઈયુ’ તથા સ્થાનિક સંગઠન ‘પરમાર્થ સમાજ સેવા સંસ્થાન’ના સહયોગથી અવાર-નવાર દુકાળનો ભોગ બનતા બુંદેલખંડ ખાતે કાર્યરત છે. અમારા કાર્યક્રમે હેઠળનાં ગામોમાં પરમાર્થના સહકારથી મહિલાઓનું જૂથ તૈયાર કરવામાં આવ્યું છે, જે ‘જળ સહેલી’ તરીકે ઓળખાય છે. આ જૂથ જળ સ્લોટોના વ્યવસ્થાપન તથા જળ સંચયને લગતી કામગીરી હાથ ધરે છે અને તેમના જળ સંબંધિત હક્કો માટે લડત ચલાવે છે. આ લેખ દિશા ઉપર દ્વારા લખવામાં આવ્યો છે અને તા. 27મી જૂન, 2017 રોજ <http://welthungerhilfeindia.org/the-water-warriors-women-lead-the-way-in-bundelkhand/> પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, તેનું ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવ્યું છે.

સીમા દેવી ‘ધામના’ ગામ સ્થિત જળ સહેલી છે. તેઓ દ્રઢ નિશ્ચયી અને અડગ છે. તેઓ તેમના હક્કો માટે, તેમના ગામના વિકાસ માટે અને જીવનની પાયાની જરૂરિયાત - પાણી માટે લડત ચલાવે છે. તે જળ વીરાંગનાઓ છે. જળ સહેલી તરીકે ઓળખાતી સીમા દેવી, પુનિયા દેવી અને કુંતી દેવી ઉત્તર પ્રદેશના બુંદેલખંડની રહેવાસી છે. તેમનાં ગામો ભલે જુદાં-જુદાં હોય, પણ તેમનો હેતુ એકસમાન છે - સૌને પાણીની સુવિધા પ્રાપ્ત થાય. આ હેતુ પાર પાડવા માટે તેઓ ભારે સંઘર્ષ કરે છે. તેઓ તેમના ગામમાં ફ્રાન્સ-તળાવ ખોએ છે, સમુદ્ધાયની નજીક ચેક ડેમ બાંધે છે, હેન્ડ પર્મ રિપેર કરે છે અને વરસાદી પાણીનો સંગ્રહ કરે છે.

મામના ગામનાં કુંતી દેવી જણાવે છે, આ અસ્તિત્વનો સવાલ છે. અમારું ગામ પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે. પીવાનું પાણી ક્ષારયુક્ત છે. અમારા ગામમાં 45 હેન્ડ પર્મ આવેલાં છે, જેમાંથી ખારું પાણી આવે છે. આ પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. આદર્શ રીતે જોતાં તો, અમને સરકારની પાણી

| હેન્ડપર્મ રિપેર કરતી જળ સહેલીઓ



પુરવઠા યોજનામાંથી નિયમિતપણે પાણી મળવું જોઈએ. પરંતુ, વીજળીની તંગીને કારણે અમને તે પાણી અઠવાડિયામાં બે જ વખત મળે છે. ટ્યુબ વેલમાંથી પાણી મેળવવા માટે મહિલાઓએ માઇલો દૂર જવું પડે છે. પરિણામે, તેમના આરોગ્ય પર આની વિપરિત અસર પડે છે. અમારી માતાઓ, દાદી અને પરદાઈઓએ પાણી મેળવવા માટે ઘણો પરિશ્રમ કરવો પડતો. અમારે પણ એ જ કરવું પડે છે. પણ હવે આ નહીં ચાલે. પણ, અમે અમારી દીકરીઓને હેરાન નહીં થવા દઈએ. અમે ઈચ્છાએ છીએ કે તેઓ અભ્યાસ કરે. કુંતી દેવી સાથે સહમત થતાં સીમા દેવી જણાવે છે, અમને સમજાઈ ગયું કે જો અમારે કોઈ સમસ્યા હોય, તો તેનો ઉપાય અમારે અમારી મળે જ કાઢવો પડશે. બીજા કોઈની મદદની આશા રાખી શકાય નહીં.

### અડચણોનો સામનો

ધાર્યા પ્રમાણે જ, શરૂઆત સરળ નહોતી. પરિવાર હોય, જ્ઞાતિ હોય કે પછી સમુદ્ધાય હોય - તેમણે દરેક તબક્કે અડચણોનો સામનો કરવો પડ્યો. સીમા જણાવે છે તેમ, શરૂઆતમાં જ્યારે મેં જળ સહેલી તરીકે કામ કરવાનું ચાલુ કર્યું, ત્યારે ગામનાં ઘણાં લોકોએ મારા પતિને એવું કહીને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો કે મારે પુરુષો સાથે બેઠકોમાં ભાગ લેતાં શરમાવું જોઈએ. પાણી વખત તેઓ કહેતાં કે ઘરની બહાર નીકળીને આવાં કાર્યો કરીને હું આપણી સંસ્કૃતિનો નાશ કરી રહી છું. મેં મારા પતિ સાથે અમારાં કાર્યોની ચર્ચા કરી અને કેટલીક બેઠકોમાં પણ હું તેમને સાથે લઈ ગઈ. જ્યારે તેમણે સ્વયં જોયું કે અમે ગામના વિકાસ માટે પ્રયત્નશીલ છીએ, ત્યારે તેમણે પણ મને મદદ કરી. આખરે, ધીમે-ધીમે સમુદ્ધાયના મારા તરફના અને અમારાં કાર્યો તરફના વલાણમાં પરિવર્તન આવ્યું. તેને યોગ્ય પગલું ગણાવતાં પુનિયા દેવી જણાવે છે, જળ સહેલી મારા માટે સશક્તિકરણની પ્રક્રિયા બની રહી. મારામાં આત્મવિશ્વાસનો

સંચાર થયો. હવે હું કોઈ પણ ગ્રાકારના ખચકાટ વિના સરકારી અધિકારીઓને મળી શકું દું તથા અમારા પ્રશ્નો રજૂ કરી શકું દું. હંમેશા ઘરની ચાર દીવાલોમાં કેદ રહેલી અને પરિવાર સિવાયના બહારના કોઈ પુરુષ સાથે એકલા વાત કરવાની પણ જેમને છૂટ ન હોય, તેવી મહિલાઓ માટે આ પહેલ નવી અને અસામાન્ય છે.

| ગામમાં યોજાયેલી બેઠકમાં પુનિયા દેવી




## મહિલાઓને સાંકળવી

જગ સહેલીનો વિચાર સૌપ્રથમ આ પ્રદેશના સ્થાનિક સંગઠન ‘પરમાર્થ સમાજ સેવી સંસ્થાન’ દ્વારા ‘યુરોપીયન યુનિયન’ અને ‘વેલ્થંગરહિલ્ફ’ના સહકારથી અમલમાં મૂકાયેલા ‘ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, 2011’ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.

વર્ષો વીતવા સાથે પહેલ પામેલી આ પહેલને ‘યુરોપીયન યુનિયન’ની નાણાંકીય સહાય ધરાવતા ‘બિલ્ડિંગ ગ્રાસરૂટ્સ સિવિલ સોસાયટી કેર્સ ફોર ઇંફેક્ટિવનેસ એન્ડ ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ’ હેઠળ વેગ મળ્યો. વેલ્થંગરહિલ્ફ દ્વારા ઉત્તર પ્રદેશ સહિતનાં છ રાજ્યોમાં આ પ્રોજેક્ટનો અમલ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, જગ સહેલીએ તેમનાં સંબંધિત ગામોમાં અનૌપચારિક સમિતિઓ રચ્યો છે, જે

| ગ્રામજનો સાથે બેઠકમાં સહભાગી થતાં જગ સહેલી પુનિયા દેવી



પાણી પંચાયત તરીકે ઓળખાય છે. પાણી પંચાયત એ પાણીના પ્રશ્નો અંગે મહિલાઓને સાંકળવા માટેનો મંચ પૂરો પાડે છે. આ પાછળનો હેતુ આ પ્રદેશમાં ખાસ કરીને પાણી અને આજીવિકાને લગતા પ્રશ્નોમાં મહિલાઓની સહભાગિતા વધારવાનો છે. જગ વ્યવસ્થાપન હોય, જગ સંચય હોય, પાણીનાં જૂનાં બાંધકામોનું પુનઃનિર્માણ કરવાનું હોય કે પછી સ્વચ્છતા, આરોગ્ય, રોજગારી અને ગામના સમગ્રતયા વિકાસના પ્રશ્નો હોય, પાણી પંચાયત ગામના તમામ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાના મંચ તરીકે કાર્ય કરે છે. પુનિયા દેવી કહે છે તેમ, આ સ્થળે અમે અમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરીએ છીએ અને સામૂહિક ધોરણે તેનો ઉકેલ લાવવા માટેના ઉપાયો શોધીએ છીએ.

## નિર્ણાયક ભૂમિકા

હાલમાં, બુદ્ધેલબંડના દુકાળગ્રસ્ત ગામોમાં વેલ્થંગરહિલ્ફના અને ‘યુરોપીયન યુનિયન’ની સહાય ધરાવતાં 130 ગામોમાં 260 જગ સહેલીઓ કાર્યરત છે. તે પૈકીની મોટા ભાગની જગ સહેલીઓ કથિત ઉચ્ચ જ્ઞાતિઓના દમન અને બહિષ્કારનો ભોગ બનેલા દલિત અને આદિવાસી સમુદ્યાયની છે. તેમનું મુખ્ય કાર્ય પાણી, આજીવિકા અને વિકાસને લગતા પ્રશ્નો અંગેની ગ્રામ સ્તરની બેઠકમાં સામેલ થઈને વહીવટી પ્રક્રિયામાં ભાગ લેવાનું છે. તેઓ ગામ માટેની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદ કરે છે. સાથે જ, પાણીના સમાન વિતરણ, નવાં જગ એકમો રચવાની જરૂરિયાત તથા બંધ હાલતમાં પડેલાં એકમોને સરકારી ગ્રામીણ રોજગારી યોજના (અમણ્ણનરેગા)ની સહાય થકી પુનઃજીવિત કરવાની જરૂરિયાતની આકારણી કરવી વગેરે પ્રશ્નો સહિત જગ સોતોના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ કાર્યો અસરકારક રીતે પાર પાડવામાં પરમાર્થ તેમને મદદ કરે છે. પરમાર્થ પાણી (પાણીની સુવિધા ધરાવવાના) અધિકાર જેવા મુદ્દાઓ અંગે તેમને જાણકારી અને તાલીમ પૂરાં પાડવાં, સરકારની કાર્યરત રોજગારી યોજનાઓ અને

| જગ સહેલીઓ હવે સ્થાનિક સત્તાધીશો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે.



પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઇ) અંગેનાં ધોરણો અને માર્ગદર્શિકાઓ વિશે સમજૂતી આપવાથી લઈને જળ સુરક્ષા યોજના તૈયાર કરવી, સામાજિક હિસાબ તપાસણી હાથ ધરવી, આઇટી તકનીકોનો ઉપયોગ કરવો, પાણીની ગુણવત્તા પર નજર રાખવી અને હેઠાં પદ્ધતિનું રિપેરિંગ કરવા જેવાં કૌશલ્ય-કેન્દ્રી કાર્યો માટેની તાલીમ તથા સહાય પૂરાં પાડે છે.

## પ્રભાવ

પરિણામો સ્પષ્ટ છે. જળ સહેલીના પ્રત્યક્ષ પ્રયત્નો મારફત, નવાં 56 જળ એકમો તૈયાર કરવામાં આવ્યાં છે અને પુનઃ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં તળાવ અને ચેક ડેમનો સમાવેશ થાય છે, જેના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંચ્યું આવ્યું છે. વિવિધ હિસ્સાધારકોની સહભાગિતાને પગલે 112 જળ એકમો બાંધવામાં આવ્યાં છે. ગ્રામીણ સ્તરે જળ એકમોની જાળવણી અને વ્યવસ્થાપન માટે ખાસ ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે. જળ સહેલીઓ અસરકારક સંદેશાવાહક બનીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ખેતી માટેની સાતત્યપૂર્ણ પદ્ધતિઓ હાથ ધરવા અંગેની જગ્યાતિ ફેલાવવામાં નોંધપાત્ર યોગદાન પૂરું પાડે છે. આ ઉપરાંત તેઓ જીવન જીવાનો અધિકાર, ગૌરવપૂર્ણ જીવન જીવાનો અધિકાર, કામ કરવાનો અધિકાર, સમાનતાનો અધિકાર વગેરેનો ભંગ કરનાર વ્યક્તિ સામે પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કાનૂની કાર્યવાહી પણ કરે છે. સ્વાભાવિક રીતે જ, તેમના આ પ્રયત્નોએ માધ્યમોનું વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત તેમના આ પ્રયત્નો

બદલ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની પ્રશંસા થઈ ચૂકી છે.



| સીમા સહિતની અન્ય જળ સહેલીઓ પાણીની સમાન પ્રાપ્તા માટે કાર્યરત છે.

પરંતુ, તેમનું ધ્યેય હજુ પાર નથી. પડ્યું. પાણીના હક્કો માટેના ચુસ્ત હિમાયતીઓ હોવાને પગલે તેઓ વોટર સિક્યોરિટી એક્ટ તથા નદીઓને પુનઃજીવિત કરવાની નીતિ (રિવર રિજુવિનેશન પોલિસી) અમલમાં લાવવા માટે રાષ્ટ્રીય સ્તરના ચળવળકર્તાઓ સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે. આ પગલાંથી તમામ સમૃદ્ધાયોને સમાન ધોરણો પાણી પ્રાપ્ત થશે તેવી તેમને આશા છે. સીમા દેવીએ હકારાભક્તાથી છલકાતા સ્મિત સાથે જણાવ્યું હતું કે, ‘હું આપણાં ગામડાંઓને સમૃદ્ધ જોવા ઈચ્છું છું. હું ઈચ્છું છું કે દરેક ઘરને પીવાનું પાણી પ્રાપ્ત થાય. અને તેના માટે જ અમે કાર્યરત છીએ. આ તો હજુ શરૂઆત છે.’ ■

## પૃષ્ઠ દનું શેષ

પ્રશ્નો આ નેટવર્ક મારફત ઊઠાવવા જોઈએ.

- ‘રાઇટ ટુ હિયરિંગ એક્ટ’ હેઠળ પંચાયત સ્તરે ફરિયાદ નોંધણી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સ્તરે માગ કરવી જોઈએ.
- ફરિયાદીને રજૂઆતની છેલ્લી તક મળતી હોય છે તે ખરાઈની વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે.

## ચાવીઝપ મુદ્દા

- લોકોને તેમના હક્કો અને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે યોજનાઓ અને કાર્યક્રમો અથવા તો લોકોએ તેમના હક્કો માટે કરેલી માગણીઓ અંગેની માહિતીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે, તે પૂરતું નથી. જ્યારે લોકો વાસ્તવમાં તેમને મળવાપાત્ર અધિકારો અને લાભો મેળવે, ત્યારે જ પહોંચમાં સુધારો કરવાનું લક્ષ્ય સિદ્ધ થયું ગણાશે.
- ફરિયાદ નિવારણની વ્યવસ્થા લાભથી વંચિત રહેનારા અથવા

તો પૂરો લાભ ન મેળવી શકનારા લોકોને તેમના હક્કો અને લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે.

- ફરિયાદ નિવારણની વ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લોકો ઘણી મર્યાદિત માહિતી તથા સમજ ધરાવે છે. બીજી તરફ અધિકારીઓ તથા કર્મચારીઓ લોકોની ફરિયાદ ઉકેલવા માટે સ્વયંને ઉત્તરદાયી નથી ગણતા.
- સાતત્યપૂર્ણતા સુનિશ્ચિત થાય તે માટે લોક સમૂહને ગામ સ્તરની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે સક્ષમ કરવો જોઈએ.
- ફરિયાદ સંબંધિત વિભાગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જેટલું જરૂરી છે, તે નિરાકરણના તબક્કા સુધી પહોંચે ત્યાં સુધી તેની સ્થિતિની આણકારી મેળવતા રહેવું પણ એટલું જ જરૂરી છે. સ્થિતિની નિયમિતપણે આણકારી મેળવતા રહેવાથી નિરાકરણના દરમાં સુધારો થઈ શકે છે.
- ફરિયાદને લગતા સરકારી ઠરાવો, સાક્ષીઓની જુબાની સાથેની લેખિત ફરિયાદો અને નિયમો અને માર્ગદર્શિકાઓ જેવાં દસ્તાવેજો સુપરત કરવાથી અધિકારીઓ જડપી કાર્યવાહી હાથ ધરે છે. તે જ રીતે સામૂહિક દબાણ પણ ઉપયોગી નીવડે છે.



### विकास शिक्षण संगठन

જ-૧, ૨૦૦, આજાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફોન: ૦૭૯-૨૭૭૪૯૯૪૫, ૨૬૭૩૩૨૮૯

ફેક્સ: ૦૭૯-૨૬૭૪૩૭૫૨. ઈ-મેલ: sie@unnati.org વેબસાઈટ: [www.unnati.org](http://www.unnati.org)

ક્ષેત્રીય કાર્યાલય: કુદુરૂ, રાધાકૃષ્ણાપુરમ, લહેરિયા રિસોર્ટની નજીક, ચોપાસની-પાલ બાધ-પાસ લિંક રોડ, જોધપુર-૩૪૨૦૧૪, રાજસ્થાન.

ફોન: ૦૨૯૧-૩૨૦૪૯૯૮ ઈ-મેલ: jodhpur\_unnati@unnati.org

આ બુલેટિનનાં લેખોમાં મંતવ્યો લેખકોના વ્યક્તિગત છે.

**દીપા સોનપાલ**, ઈ-મેલ: sie@unnati.org, **રમેશ પટેલ**, ઈ-મેલ: publication@unnati.org

મુદ્રણ: પ્રિન્ટવિઝન, અમદાવાદ.

ફક્ત અંગત વિતરણ માટે

આપ લોકશિક્ષણ કે તાલીમ માટે 'વિચાર'માં પ્રકાશિત સામગ્રીનો સહર્ષ ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરનારને વિનંતી કે આ સોતનો ઉલ્લેખ કરવાનું ના ભૂલે તથા પોતાના ઉપયોગથી અમને માહિતગાર કરે કે જેથી અમે પણ કંઈક શીખી શકીએ.